



## પ્રકરણ - ૩૦ પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી



### દવાઓની સૂચી

|  |     |                                |     |                             |     |
|--|-----|--------------------------------|-----|-----------------------------|-----|
| અસીટામીનોફેન                           | ૫૦૦ | ડાયઝેપામ                       | ૫૧૮ | મેટ્રોનિકોલ                 | ૫૩૮ |
| અસાઇક્લોવિર                            | ૫૦૦ | કલોક્સાસિલિન                   | ૫૧૯ | મીફ્પીસ્ટોન                 | ૫૩૯ |
| અટ્રીનાલીન                             | ૫૦૧ | ડાયફિનિથાય્ડેમાઈન              | ૫૨૦ | મીસોપ્રોસ્ટોલ               | ૫૪૦ |
| અમોક્ષિસીલીન                           | ૫૦૧ | હાયફ્રોક્લોરાઈટ                | ૫૨૦ | નાઈટ્રોફ્યુરેન્ટોઈન         | ૫૪૧ |
| અમોક્ષિસીલીન અને કલેવ્યુલેનેટ પોટેશીયમ | ૫૦૨ | ડોક્સીસાયક્લિન                 | ૫૨૧ | નોરક્લોક્સાસીન              | ૫૪૨ |
| અમ્પીસીલીન                             | ૫૦૩ | એપીનેક્ટીન / અટ્રીનાલીન        | ૫૨૨ | નીસ્ટેટીન                   | ૫૪૩ |
| અપીરીન                                 | ૫૦૪ | અગોમેટ્રીન મેલીઅટ              | ૫૨૩ | ઓક્સીટોસીન                  | ૫૪૪ |
| અઝીથ્રોમાઈસીન                          | ૫૦૫ | એરીથ્રોમાયસીન                  | ૫૨૪ | પેરાસિટ્મોલ (અસીટામીનોફેન)  | ૫૪૫ |
| અઝેક્ટી                                | ૫૦૫ | ઇસ્ટ્રોજન                      | ૫૨૫ | પેનિસીલીન                   | ૫૪૬ |
| બેન્જાથીન પેનિસીલીન                    | ૫૦૬ | જેન્શન વાચોલેટ                 | ૫૨૭ | પ્રોબેનેસીડ                 | ૫૪૮ |
| બેન્જાઈલપેનિસીલીન                      | ૫૦૭ | હીપેટાઈસ-બી વેક્સિન            | ૫૨૮ | પ્રોકેઇન પેનિસીલીન          | ૫૪૯ |
| સેફ્ફિક્ઝાઈમ                           | ૫૦૮ | હાઇફ્રોકોર્ટીસોન (કોર્ટીસોન)   | ૫૨૯ | પ્રોજેસ્ટેરોન - પ્રોજેસ્ટીન | ૫૪૯ |
| સેફ્ફાયાક્ઝોન                          | ૫૦૯ | હાઇફ્રોક્સીઝીન                 | ૫૩૦ | પ્રોમિથાઝિન                 | ૫૫૦ |
| સેફાલેક્સીન                            | ૫૧૦ | આઈબુપ્રોફેન                    | ૫૩૧ | પાયરાશીનેમાઈટ               | ૫૫૧ |
| ચારકોલ                                 | ૫૧૧ | આઈસોનીઆઝીડ                     | ૫૩૨ | રીફામ્પીસીન                 | ૫૫૨ |
| કલોરેમફેનીકોલ                          | ૫૧૨ | કેનમાયસીન                      | ૫૩૩ | સ્ટ્રેપ્ટોમાયસીન            | ૫૫૩ |
| સીપ્રોફ્લોક્સાસીન                      | ૫૧૩ | ક્રીટોકોનેક્ઝોલ                | ૫૩૪ | સલ્વીસોક્લેકોલ              | ૫૫૪ |
| કલોટ્રાયમેક્ઝોલ                        | ૫૧૪ | મેનેશિયમ સલ્ફેટ                | ૫૩૫ | ટિટેનસ ટોક્સોઈટ             | ૫૫૪ |
| કોડીન                                  | ૫૧૫ | મિન્ડોક્સીપ્રોજેસ્ટીરોન એસીટીટ | ૫૩૬ | ટેટ્રાસાયક્લિન              | ૫૫૫ |
| કો-ટ્રાયમોક્ઝાઝોલ                      | ૫૧૬ | મિથાઈલ અગોનોવિન                | ૫૩૭ | થાયાસિટોન                   | ૫૫૬ |
| કેક્સામેથેઝોન                          | ૫૧૭ | માઈકોનેક્ઝોલ                   | ૫૩૮ | ગર્ભનિરોધક ગોળીઓ            | ૫૫૭ |

## પુસ્તકમાં સૂચનેલી દવાઓ વિશે માહિતી

લીલા રંગના પાન ઉપર આપેલી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચે લખેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો :

**દવાઓની માહિતી :** આ પાનાં ઉપર આ પુસ્તકમાં આપેલી દવાઓનો સમાવેશ કર્યો છે. દવાઓ અંગે સામાન્ય માહિતી માટે 'સ્વી સ્વાસ્થ્ય માટે દવાઓવાળું, પ્રકરણ જેવાનું ચૂકશો નહિ. આ લીલાં પાન ઉપર દવાઓ અંગેજ કક્કા પ્રમાણે આપવામાં આવેલી છે. એટલે કે દવાના નામનો પહેલો અક્ષર અંગેજ કક્કાવારી a, b, ..... , x, y, z ના ક્રમમાં ગોઠવીને દવાઓ વિશે માહિતી આપવામાં આવેલી છે. દા.ત. મેટ્રોનીડાઝોલ ડોકસી સાઈકલીન પછી આવે, પણ પેનીસીલિનથી પહેલાં આવે છે. એક જ દવા અનેક (બજરુ) છાપ-માર્ક-બ્રાન્ડના નામથી બજરમાં વેચાતી હોય છે. દવાઓના નામો જનરિક એટલે કે તેના અસલ-વૈજ્ઞાનિક નામો વાપર્યા છે.

લીલાના પાન ઉપર દવા શોધવા તમે રોગ ક્રમાંક પ્રમાણે અને દવાઓનાં નામના ક્રમાંક પ્રમાણે શોધી શકો છો.

**રોગ પ્રમાણે ક્રમાંક :** (પાન નં. ૪૮૭-૪૮૮) આ પુસ્તકમાં લેવામાં આવેલા રોગ/રોગની સમસ્યાઓને અંગેજ કક્કા પ્રમાણે આપેલ છે. સાથે જે તે રોગમાં વપરાતી દવા પણ આપેલ છે. ધ્યાન રહે કે ફક્ત દવાઓ જ રોગનો સંપૂર્ણ ઠિલાજ નથી, માટે જે તે રોગ વિશે જે તે પાનાં વાંચી જડરી જાણકારી મેળવો અને પછી જ દવાઓ ઉપયોગ કરો.

**દવા પ્રમાણે ક્રમાંક :** (પાન નં. ૪૮૫) દવાઓનાં અસલ વૈજ્ઞાનિક નામ પ્રમાણે અંગેજ કક્કાવાર યાદી આપેલ છે. દવા સામે આપેલ પાન નંબર ઉપર દવા વિશે જેઠિતી માહિતી મળશે.

દરેક દવા માટેની માહિતી નીચે બતાવેલ બોક્સ-કોષ્ટ પ્રમાણે આપેલી છે.

|   |  |   |
|---|--|---|
| <b>અસલ વૈજ્ઞાનિક નામ</b> → દવા વિશે સામાન્ય માહિતી અહિ આપેલ છે.<br><br><b>કોણાના બીજા ભાગોમાં દવાનો ઉપયોગ સલામતીપૂર્વક તથા સાવયેનીથી અને ચોકસાઈથી ડેવી રીતે કરવો તેની માહિતી આપેલ છે.</b> | <b>અસલ વૈજ્ઞાનિક નામ</b> → એસાઇક્લોવીર<br><br><b>દવા વિશે સામાન્ય માહિતી અહિ આપેલ છે.</b>  | <b>ને દવાઓ સગરાં ક્રી અને ધાત્રી માતાએ ન વાપરવી જોઈએ તેના ઉપર ચોકડી કરેલ છે.</b><br><b>જ્યાં ચેતવણી લખીને ચોકડી વગરના આ ચિંતો છે, તે દવાનો ઉપયોગ ડોકટરની સૂચના મુજબ જ કરવો.</b> |
|   | <b>એસાઇક્લોવીર</b>   |   |
|   | <b>અસલ વૈજ્ઞાનિક નામ</b> → એસાઇક્લોવીર વાયરસ-વિલાશુનાશક દવા છે. લાર્પીસમાં ભાલ્ય જનનેન્દ્રિયો, ગુદા પર અને મૌંનાં દુઃખદાખલ ફોલવીએ થાય છે.<br>એસાઇક્લોવીર લાર્પીસ રોગમાં કામ આવે છે. આ દવાની લાર્પીસ રોગ અટકાવી શકતો નથી. પણ એ લાર્પીસનું દુઃખ ઓછું કરે છે અને તેને ફેલાતો અટકાવે છે. |   |
|   | <b>દવાના ઉપયોગ</b><br><b>સ્વરૂપો :</b> ગોળીઓ : ૨૦૦, ૧૦૦ કે ૮૦૦ મી.ગ્રા. મલમ - ૫%   | <b>ઉપયોગી માહિતી :</b> મલમ કરતાં ગોળીઓ વધારે અસરકારક છે. ખૂબ પાણી પીવું.  |
|   | <b>ક્યારે અને કેટલી</b><br><b>માત્રામાં લેવી :</b> ૨૦૦ મી.ગ્રા.મ દિવસમાં પાંચ વખત ૭ થી ૧૦ દિવસ માટે લેવી.  | <b>આડમાસર :</b> કોઈક વાર માણું દુઃખે, ચક્કર આવે, ડુબકા કે ઉલ્લા થાય.  |
|   | <b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b> મુગંડિ-કીડનીની બિમારીઓના દર્દીઓ ન લેવી.  | <b>દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જાય તો :</b> માણું દુઃખે, યાદરાંદિત ઓછી થાય, ડુબકા આવે પેશાદ થતો બંધ થઈ જાય.  |

## પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી

---

### રોગ/આરોગ્ય સમસ્યા ક્રમાંક

આ પુસ્તકમાં ચર્ચવામાં આવેલ આરોગ્ય સમસ્યાઓની આ કક્ષાવાર યાદી છે. પહેલા કોલમ-સ્તંભમાં રોગનું નામ છે. બીજા કોલમમાં આરોગ્ય વિશેની માહિતી કયા પાન ઉપર મળશે તે આપેલ છે. દવાનો ઉપયોગ કરતાં પહેલાં આ માહિતી જરૂરથી ધ્યાનથી વાંચવી. ત્રીજ કોલમમાં આ રોગમાટે આ પુસ્તકમાં સૂચવેલી દવાઓના નામ આપેલ છે. દવાની માહિતી માટે જે તે દવાનો કોડો ધ્યાનપૂર્વક વાંચો.

| અંગેળુમાં સમસ્યાનું નામ  | રોગ/સમસ્યા  | પાન નંબર          | પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી   |
|--|---|-------------------|--|
| arthritis  | સંધિવા/વા   | ૧૩૧               | એસ્પીરીન, ઇબુપ્રોફેન   |
| bleeding from the vagina<br>after abortion<br>after childbirth<br>around menopause | યોનિમાંથી રક્તસ્ખાવ<br>ગર્ભપાત પછી<br>સુવાવડ પછી<br>રણે નિવૃત્તિ સમયે | ૨૪૦<br>૮૨<br>૧૨૭  | એરગો મેટ્રીન,<br>એરગોમેટ્રીન, ઓક્સીટોસીન<br>મેટ્રોક્સી પ્રોજેસ્ટરોન  |
| chancroid  | જાતિય રોગ   | ૨૫૮               | સીપ્રોફલોક્ષાસીન, ઈરીશ્રોમાયસીન, કોટ્રાઇમેક્ષાઝોલ  |
| chlamydia  | જાતિય રોગ   | ૨૫૯               | કોટ્રાઇમેક્ષાઝોલ, ડોક્સિસાઈકલીન  |
| cough  | ખાંસી   | ૨૮૯               | કોડીન  |
| diarrhea   | ઝાડા  | ૨૮૫               | કોટ્રાઇમેજોલ, મોટ્રોનીડેજોલ નોરફલોક્ષાસીન  |
| emergency birth control  | તાત્કાલિક ગર્ભનિરોધ   | ૨૧૪               | ઓછી માત્રાવાળી ગોળી  |
| fever<br>after abortion<br>after childbirth  | તાવ<br>ગર્ભપાત પછી<br>બાળજન્મ/સુવાવડ પછી                              | ૨૮૫<br>૨૪૪<br>૮૭  | એસ્પીરીન, પેરાસીટિમોલ, ઇબુપ્રોફેન<br>એમોક્ષીસીલીન, કોક્સિસાયકલીન, મેટ્રોનીડાઝોલ<br>એમોક્ષીસીલીન, મેટ્રોનીડાઝોલ, પ્રોકેન<br>પેનીસીલીન, કલોરેમ્ફેનીકોલ |
| during labour  | સુવાવડ-પ્રસુતિ દરમ્યાન  | ૮૭                | એમ્પીસીલીન, પ્રોકેન પીનીસીલીન  |
| fits during pregnancy  | સગર્ભ બેનને જેંચ આવવી   | ૭૫,૮૭             | ડાયજેપામ, મેગનેશીયમ સલ્ફેટ   |
| fungal infection<br>mouth (thrush)<br>skin<br>vagina                               | કૂગનો ચેપ<br>મોં<br>ચામડી-ત્વચા<br>થોનિ                               | ૨૮૧<br>૨૮૭<br>૨૫૧ | જેન્શન વાયોલેટ, કીટોક્ષોનાઝોલ, નીસ્ટાટીન<br>જેન્શન વાયોલેટ, કીટોકેનાસોલ, નીસ્ટાટીન<br>જેન્શન વાયોલેટ, કલોટ્રાઇમેજોલ,<br>માઇકોનેજોલ, નીસ્ટાટીન,       |

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

---

|   |   |                   |   |
|---|---|-------------------|---|
| gonorrhea                                       | ગોનોરીથા  | ૨૫૩               | સેફીક્જીમ, સેફીએક્ઝોન, સીપ્રોફ્લોક્સાસીન, કોટ્રાઈમેક્જાઝોલ, ડોક્ષીસાયકલીન, કેનામાયસીન, મેટ્રોનીડાઝોલ, નોર્ફલેક્સાસીન                                      |
| herpes sores                                    | હર્પીસ ચાંદા કે ફોલ્લા                                    | ૨૮૮               | એસાયકલોવીર  |
| infection (prevention)                          | ચેપ (અટકાવવા માટે)  | ૨૩૬               | એમોક્ષીસીલીન, ડોક્ષીસાયકલીન, એમોક્ષીસીલીન, ઈરીથ્રોમાયસીન,   |
| infection (treatment)<br>after abortion         | ચેપ (સારવાર માટે)<br>ગર્ભપાત પછી                          | ૨૪૪               | એમોક્ષીસીલીન, બેન્જાઇલ પેનીસીલીન, કલોરેમ્ફેનીકોલ, ડોક્ષીસાયકલીન, ઈરીથ્રોમાયસીન, જેન્ટામાયસીન, મેટ્રોનીડેઝોલ   |
| bladder<br>breast infection<br>after childbirth | મૂત્રાશથણો ચેપ<br>સ્તનનો ચેપ<br>સુવાખ બાદ                 | ૩૪૮<br>૧૧૨<br>૬૭  | એમોક્ષીસીલીન, કોટ્રાઈમેક્જાઝોલ<br>કલોક્ષાસીલીન, ઈરીથ્રોમાયસીન<br>એમોક્ષીસીલીન, કલોરેમ્ફેનીકોલ, ઈરીથ્રોમાયસીન, મેટ્રોનીડાઝોલ, પેનીસીલીન, પ્રોકેન પેનીસીલીન |
| kidney  | મૂત્રપિંડ   | ૩૫૮               | એમોક્ષીસીલીન, કોટ્રાઈમેક્જાઝોલ<br>એમ્પીસીલીન, જેન્ટામાયસીન  |
| itching<br>of the genitals<br>of the skin       | ચેપ/ખંજવાળ<br>જનનેન્દ્રીયમાં<br>ચામડી-ત્વચા               | ૨૫૨, ૨૫૩<br>૨૮૬   | જેન્શન વાયોલેટ, મેટ્રોનીડાઝોલ, કોટ્રાઈમેક્સાઝોલ<br>ડાયફેનહાઇડ્રેમાઇન, હાઇડ્રોકોર્ટીસોન,   |
| nausea  | ઉબકા/ઉલ્લી  | ૨૮૮               | પ્રોમીથેઝીન   |
| newborn eye care                                | નવજાત શિશુની<br>આંખની સંભાળ માટે                          | ૮૪                | ઈરીથ્રોમાયસીન મલમ, ટેટ્રાસાયકલીન મલમ<br>કલોરેમ્ફેનીકોલ આંખનો મલમ  |
| pain<br>mild to moderate<br>severe              | કુંખાવો થવો/<br>પીડા થવી<br>સામાન્ય<br>તીવ્ર-ખૂબ પીડા થવી | ૪૬૦<br>૪૬૧<br>૪૬૨ | એસ્પીરીન, પેરાસીટિમોલ, ઈલ્યુપ્રોફેન<br>કોડીન  |
| pelvic inflammatory<br>disease (PID)            | પેઢાનો ચેપ  | ૨૬૨               | ડોક્ષીસાયકલીન, મેટ્રોનીડાઝોલ,<br>નોર્ફલેક્સાસીન   |

---

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|                                   |                                    |                   |   |
|-----------------------------------|------------------------------------|-------------------|---|
| pneumonia for people with AIDS    | અદ્યાત્મિક હૃદાનંદના વરાધ          | ૨૬૦               | કોટ્રાઈમેક્જાઝોલ  |
| sores, infection                  | ચેપવાળું ચાંદુ                     | ૨૬૧               | બેન્જાથીન પેનીસીલીન, ઈરીથ્રોમાયસીન  |
| sores, infection on the genitals  | જનનેન્દ્રીય પર ચેપવાળું ચાંદુ      | ૨૫૭               | બેન્જાથીન પેનીસીલીન, ઈરીથ્રોમાયસીન  |
| syphilis                          | સીફીલીસ                            | ૨૫૮               | બેન્જાથીન, પેનીસીલીન, ડોક્ષીસાયકલીન, ઈરીથ્રોમાયસીન, ટેફ્રાસાયકલીન                   |
| tetanus in newborn                | નવજનત શિશુને ધનૂર                  | ૮૫                | પેનીસીલીન   |
| toxemia/fits                      | ડોક્ષેમીયા-તાણા                    | ૭૫, ૮૭            | મેગનેશીયમ સલ્ફેટ, ડાયેપામ   |
| trichomonas                       | ડ્રાઇકોમોનાસ                       | ૨૫૩<br>૨૫૫        | મેટ્રોનીડિઝોલ   |
| vaginal discharge at risk for STD | પોનિસ્વાવ<br>જતીય રોગના જોખમવાળાને | ૨૫૧<br>૨૫૧        | કોટ્રાઈમેક્જાઝોલ, ડોક્ષીસાયકલીન,<br>મેટ્રોનીડિઝોલ                                   |
| not at risk for STD               | જતીય રોગના જોખમ વગરના              | ૨૫૧               | કલોકોટ્રાઈમેજોલ, જેન્શન વાયોલેટ,  |
| warts on the genitals             | જનનેન્દ્રીય પર મસા                 | ૨૫૭               | પોડોફાયલીન, ડ્રાઇકલોરો એસીટિક એસીડ  |
| womb infection                    | ગર્ભાશયનો ચેપ                      | ૮૭<br>૨૫૧<br>૨૬૨  | એમોક્ષીસીલીન, કલોરેમ્ફેનીકોલ,<br>મેટ્રોનીડિઝોલ, પેનીસીલીન,<br>પ્રોકેન પેનીસીલીન     |
| yeast, thrush                     | થીસ્ટ                              | ૧૧૩<br>૨૫૧<br>૨૬૧ | જેન્શન વાયોલેટ, કલોકોટ્રાઈમેજોલ,<br>માય્કેનોઝોલ, નીસ્ટાટીન, વિનેગાર,<br>કીટોકોનાઝોલ |



## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

**એસીટામીનોફેન અથવા પેરાસીટિમોલ** (ક્રોકીન-Crocin, મેટાસીન-Metacin)  
**Acetaminophen or Paracetamol**

એસીટામીનોફેનનું બીજું જાણીતું નામ પેરાસીટિમોલ છે. એ તાવ ઉતારે છે તથા દુઃખાવો ઓઇઝો કરે છે. એ ખૂબ સલામત દવા છે તેની આડઅસરો ખાસ નથી. તેનાથી પેટમાં ભળતરા થતી નથી. એટલે એસીડીટીની બિમારીમાં પણ લઈ શકાય છે. તેવી જ રીતે સગર્ભિબેનો પણ લઈ શકે છે. જુઓ પેરાસીટિમોલ.

**એસાઈકલોવીર** (એસીવીર-Acivir, હર્પેક-Herpex, લોવિર-Lovir, જોવિરેક-Zovirex)



એસાઈકલોવીર (વાયરસ) વિષાળું નાશક દવા છે. હર્પીસમાં બાહ્ય જનનેન્દ્રિયો, ગુદા પર અને મોંમાં દુઃખાયક ફોલ્લીઓ થાય છે. એસાઈકલોવીર હર્પીસ રોગમાં કામ આપે છે. આ દવાથી હર્પીસ રોગ અટકાવી શકતો નથી. પણ એ હર્પીસનું દુઃખ ઓછું કરે છે અને તેને ફેલાતો અટકાવે છે.

દવાના ઉપલબ્ધ સ્વરૂપો :



ગોળીઓ : 200, 400 કે 800 મી.ગ્રા.  
મલમ - 5%

ક્યારે અને કેટલી માત્રામાં લેવી :



જનનેન્દ્રિયના હર્પીસ :  
200 મી.ગ્રામ દિવસમાં પાંચ વખત 7 થી 10 દિવસ માટે લેવી.  
ચાંદા માટે : દિવસમાં 6 વાર ચાંદાં પર મલમ 7 દિવસ માટે લગાવવો.

કોણે આ દવા ન લેવી જોઈએ :



મૂત્રપિંડ (કીડની) ની બિમારીવાળા દર્દીએ ન લેવી.

ઉપયોગી માહિતી :



મલમ કરતાં ગોળીઓ વધારે અસરકારક છે.  
ખૂબ પાણી પીવું.

આડઅસર :



કોઈક વાર માથું દુઃખે, ચક્કર આવે,  
ઉબકા કે ઉલઠી થાય.

દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જય તો :



માથું દુઃખે, યાદશક્તિ ઓઇઝી થાય, ઉબકા આવે પેશાબ થતો બંધ થઈ જય.

## પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી

### એડ્રેનાલીન અથવા એપીનેફ્રીન

**Adrenalin or Epinephrin**

એડ્રેનાલીન દવા એપીનેફ્રીન તરીકે પણ ઓળખાય છે. તે પુસ્તકમાં સૂચવેલી બીજી દવાઓની એલર્જ્ક આડઅસર કે એલર્જ્ક શૉકની સારવારમાં ઉપયોગી છે, દાખલા તરીકે પેનીસીલીનની એલર્જ્ક આડઅસર થાય ત્યારે, દમના ભારે હુમલામાં પણ તેનો ઉપયોગ કરી શકાય. જુઓ epinephrine-એપીનેફ્રીન.

### એમોક્સિસીલીન (એમોક્સિલ-Amoxil, ઈડિમોક્સ-Idimox, લેમોક્સી-Lamoxy, Amoxycillin મોક્સ-Mox, નોવામોક્સ-Novamox)

એમોક્સિસીલીન એ પેનીસીલીનનો એક પ્રકાર છે. તે જીવાણુવિરોધી દવા છે. તેનો ઉપયોગ ગર્ભાશયનો ચેપ, પેશાબ માર્ગનો ચેપ, વરાધ અને બીજા ચેપમાં થાય છે. અત્યારે એમોક્સિસીલીનની જગ્યાએ એનો ઉપયોગ થાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



૨૫૦ અને ૫૦૦ મી.ગ્રામની કેપ્સ્યુલ  
૧૨૫ અને ૨૫૦ મી.ગ્રામ/૫ મી.લી. ના સીરપ  
૧૨૫ મી.ગ્રામની ગોળીઓ

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



કુલ ૨૦-૪૦ મી.ગ્રા. / કી.ગ્રામ વજન પ્રમાણે ૧ દિવસમાં ૩ વાર, ૭ થી ૧૪ દિવસ માટે લેવી.  
ક્લાઇમેડીયા, પેઢનો ચેપ, સ્તનનો ચેપ માટે ૫૦૦ મી.ગ્રા.  
દિવસમાં ૩ વાર - ૧૦ દિવસ માટે; સુવાવડ કે ગર્ભપાત બાદ થતા  
ગર્ભાશયનો ચેપ, ૧ ગ્રામ દિવસમાં ત્રણવાર, ૧૦ દિવસ માટે.  
(સાથે પુસ્તકમાં સૂચવેલી બીજી જીવાણુવિરોધી દવાઓ વિશે માહિતી વાપરી  
શકાય.)  
ગર્ભપાત બાદના ચેપને ટાળવા માટે,  
૫૦૦ મી.ગ્રા. દિવસમાં ૩ વાર - ૧ દિવસ માટે

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



પેનીસીલીનના કોઈપણ પ્રકાર  
સામે એલર્જ્ઝ હોય તો  
એમોક્સિસીલીન ન લેવી.

પુસ્તકમાં સૂચવેલી બીજી  
ઉપયોગી દવાઓ વિશે માહિતી :  
પેશાબ માર્ગ અને મૂત્રપિંડના  
ચેપ માટે :

ઉપયોગી માહિતી :



દવા શરૂ કર્યા પછી ૩ દિવસમાં સારું  
ન થાય તો ડૉક્ટરની સલાહ લો.  
કદાચ બીજી દવા શરૂ કરવી પડે.  
દવા ખોરાક સાથે લો.

કોણાઈમેક્ષાઝોલ, જેન્ટામાઇસીન,  
નોર્ફલોક્સાસીન,

આડઅસર :



આડા, ચકામા, ઉબકા, ઉલ્ટી,  
યોનિમાં ફૂગનો ચેપ કે બાળકને  
થાપામાં ફૂગનો ચેપ

સ્તનના ચેપ માટે :  
ડાઇકલોક્સાસીલીન,

એરીથ્રોમાઇસીન  
ગર્ભપાત બાદના ચેપમાં -  
ડોક્સીસાયક્લીન

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |  |
|--|--|
| <b>એમોક્સિસીલીન અને કલેવ્યુલેનેટ પોટેશીયમ</b> (ઓગમેન્ટિન-Augmentin, ક્લેવમ-Clevum,<br><b>Amoxicillin + Clavulanate Potassium</b> ક્લેવ્ટ્રોલ-Clavetrol, નોવાક્લેવ-Novaclav, વોર્ક્લેવ-Warclav)   |  |
| <p>એમોક્સિસીલીન અને કલેવ્યુલેનેટ પોટેશીયમ એપેનીસીલીન કુળની ગોનોરિયા-પરમીયા અને ચેપ સામે વપરાતી દવા છે. ધાળા સ્થળો હવે ગોનોરિયાના જવાણું ઉપર આ દવાની અસર થતી નથી. આ દવા એકલી એમોક્સિસીલીન કરતાં વધુ અસરકારક છે. પરંતુ તે મોંઘી અને ગરીબ દેશોમાં દુલભ છે. કલેવ્યુલેનેટ પોટેશીયમ એકલી છૂટી દવા તરીકે મળતી નથી. નહિ તો એમોક્સિસીલીન કલેવ્યુલેનેટ બંને સાથે આપી શકાય.</p> |  |
| દવાનાં ઉપલબ્ધ ગોળીઓ :  | એમોક્સિસીલીન ૮૭૫ મી.ગ્રા. + કલેવ્યુલેનેટ - ૧૨૫ મી.ગ્રા.  |
| સ્વરૂપો :  | એમોક્સિસીલીન ૫૦૦ મી.ગ્રા. + કલેવ્યુલેનેટ - ૧૨૫ મી.ગ્રા.  |
| સીરપ :   | એમોક્સિસીલીન ૨૫૦ મી.ગ્રા. + કલેવ્યુલેનેટ - ૧૨૫ મી.ગ્રા.  |
|  | પ્રતિ ૫ મીલી લીટર  |
| ઠિંજેકશન :   | ૧.૩ ગ્રામ વાયલ (એમોક્સિસીલીન ૧ ગ્રામ + કલેવ્યુલેનેટ - ૨૦૦ મી.ગ્રા.)<br>૬૦૦ મી.ગ્રા. વાયલ (એમોક્સિસીલીન ૫૦૦ મી.ગ્રા. + કલેવ્યુલેનેટ - ૧૦૦ મી.ગ્રા.)<br>૩૦૦ મી.ગ્રા. વાયલ (એમોક્સિસીલીન ૨૫૦ મી.ગ્રા. + કલેવ્યુલેનેટ - ૫૦ મી.ગ્રા.) |
| કયારે અને કેટલી માત્રામાં લેવી :   |  <p>ગોનોરિયા-પરમીયા માટે :<br/>૩ ગ્રામ એમોક્સિસીલીન અને કલેવ્યુલેનેટ એક સાથે ફક્ત એક ૯ વાર લેવી. આ સાથે ૧ ગ્રામ પ્રોબેનસીડ પણ લેવી.</p>       |
| કોણે આ દવા ન લેવી જોઈએ :   |  <p>પેનીસીલનના કોઈપણ પ્રકાર સામે એલજ હોય તો ન લેવી.</p>   |
| બીજી માહિતી :  | એમોક્સિસીલીન પ્રમાણે   |



## પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી

**એમ્પિસીલીન.** (એમ્પિલીન-Ampilin, એરિસ્ટોસીલીન-Aristocillin, બેસ્પેન-Bacipen, કેમ્પિસીલીન-Campicillin)  
**Ampicillin**

એમ્પિસીલીન એ પેનિસીલીન કુળની જવાણું વિરોધી દવા છે અને વિવિધ પ્રકારના ચેપ માટે ઉપયોગી છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ગોળી અને કેપ્સુલ : ૨૫૦, ૫૦૦ મી.ગ્રા.  
સીરપ : ૧૨૫ કે ૨૫૦ મી.ગ્રામ  
પ્રતિ ૫ મીલી લીટર, ૧૦૦૦ મી.ગ્રા.ની વાયત

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



સામાન્ય રીતે કુલ ૩૦ થી ૫૦ મી.ગ્રા. પ્રતિ  
એક કિલોગ્રામ વજન પ્રતિ દિવસમાં ચાર વખત ૭ થી ૧૪ દિવસ લેવી.

સ્તનનો ચેપ કે પેઢુમાં ચેપ :

૨૫૦ થી ૫૦૦ મી.ગ્રા. દિવસમાં ચાર વખત ૭ દિવસ માટે મોં વાટે લેવી,  
પેશાબ માર્ગનો ચેપ :

સગર્ભાવસ્થા ન હોય તો ત ગ્રામ એક સાથે એક જ વારમાં મોં વાટે લેવી.

જે સગર્ભા હોય તો ૨૫૦ મી.ગ્રા. દિવસમાં ૪ વખત ૭ દિવસ માટે મોં વાટે લેવી.

મૂત્રપિંડનો ચેપ : ૫૦૦ મી.ગ્રા. દિવસમાં ૪ વખત ૧૪ દિવસ માટે મોં વાટે લેવી.

જે ઉલ્ટી થતી હોય તો ૫૦૦ મી.ગ્રા.નું ઈજેક્શન સ્નાયુમાં દિવસમાં ૪ વખત લેવું.  
ઉલ્ટી બંધ થાય એટલે મોંઢેથી કેખ્યુલ લેવાનું શરૂ કરવું.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



પેનિસીલીનના કોઇપણ પ્રકાર સામે એલર્જી  
હોય તો એમ્પિસીલીન ન લેવી.

ઉપયોગી માહિતી :



આ દવા જમતા પહેલાં ભૂઘ્યા પેટે લેવી.

આડઅસર :



પેટમાં દુઃખાવો,  
ઝડપ કે ચકામાં થાય.

પુસ્તકમાં સૂચવેલી બીજી ઉપયોગી  
દવાઓ વિશે માહિતી :

પેશાબ માર્ગ અને મૂત્રપિંડના ચેપ :

એમોક્ષીસીલીન, કોટ્રાઇમેક્સાઝોલ,

નોર્ફલોક્ષાસીન

સ્તનના ચેપ માટે : એમોક્ષીસીલીન, સિફ્લિક્ષિન,  
ક્લોક્ષાસીન, એરીથ્રોમાઇસીન

ચેતવણી :



જે ત દિવસમાં સારું ન લાગે તો  
ડૉક્ટરની સલાહ લો. કદાચ દવા  
બદલવાની જરૂર હોય.

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |   |
|--|---|
| <p><b>એસ્પીરીન</b> Aspirin, Acetyl Salicylic Acid<br/>(કોલસ્પ્રીન-Colsprin, ઈકોસ્પ્રીન-Ecosprin, માઇકોપાયરીન-Micopyrine)</p> <p>એસ્પીરીન દુ:ખાવા માટે, સોજા માટે અને તાવ માટે ઉપયોગી છે.</p> <p>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો:</p>  <p>ગોળી : તરફ મી.ગ્રા. અને ૬૫૦ મી.ગ્રા.</p> <p>ક્યારે અને કેટલી માત્રામાં લેવી :</p>  <p>દુ:ખાવા માટે, સોજા (વાકે વાગવાથી) કે તાવ ત૩૦ થી ૬૦૦ મી.ગ્રા. માં વાટે એક દિવસમાં વધુમાં વધુ છ વખતથી વધારે લેવી નહિ.</p> <p>કોણે આ દવા ન લેવી જોઈએ :</p>  <p>સગર્ભાવસ્થાના છેલ્લા ત માસમાં ન લેવી.<br/>હાજરીમાં ચાંદું કે ઉલ્લીમાં લોહી આવતું હોય તેણે ન લેવી.<br/>વાગ્યા પછી લોહી નિકળતું રહે અને લોહી વહેતું ગંઠાવામાં-બંધ થવામાં વાર લાગતી હોય.<br/>સર્જરી પહેલાં ન આપવી.<br/>નવજનત શિશ્યને ન આપવી.<br/>બાળકોને તાવ, શરદી કે ઓરી-અછબડામાં ન આપવી.</p> <p>ઉપયોગી માહિતી :</p>  <p>એસ્પીરીન સંધિવા તથા હદ્યરોગમાં ઉપયોગ તરીકે ઉપયોગી છે.<br/>આ દવા દુ:ખ અને તાવમાં રાહત આપે છે. પરંતુ દુ:ખાવાનું તથા તાવનું કારણ-નિદાન નક્કી કરવું જોઈએ અને મૂળ રોગની દવા કરવી જોઈએ.<br/>જે ૧૦ દિવસમાં દુ:ખાવો ન મટે કે ૩ દિવસમાં તાવ ન મટે તો ડૉક્ટરની સલાહ લો.</p> | <p>ચેતવણી</p>  <p>અડઅસર :</p>  <p>પેટમાં દુ:ખાવો,<br/>કે લોહી વહેવાનું શરૂ થાય.</p> <p>વધુ પડતી દવા<br/>લેવાઈ જય તો :</p>  <p>કાનમાં ભણકારા, ધંટડી વાગે,<br/>માથું દુ:ખે, ચક્કર આવે,<br/>ઝડપથી શાસ ચાલે વગેરે</p> <p>ખીજુ ઉપયોગી દવાઓ :</p> <p>દુ:ખાવા કે તાવ માટે : પેરાસિટામોલ<br/>દુ:ખાવા, તાવ કે સોજા માટે : ઈબુગ્રોફેન<br/>ખૂબ દુ:ખાવા માટે : કોરેન</p> |
|--|---|

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <p><b>એજીથ્રોમાઇસીન</b> (એજી-Azee, એજીલીડ-Azilide, એજીથ્રાલ-Azithral,<br/>Azithromycin ઝીથ્રોસીન-Zithrocin)</p> <p>એજીથ્રોમાઇસીન મેકોલીડ કુળની જીવાણુવિરોધી દવા છે. જાતીય રોગો (STDs) માં તે ઉપયોગી છે. જે કે તે મૌંધી અને દુર્લભ છે પણ જાતીય રોગોમાં બીજી દવાઓ બિનઅસરકારક નીવડે ત્યારે તે અક્સરી નીવડે છે.</p> |  <p>ચેતવણી</p>  |
| <p><b>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :</b></p>    | <p>ગોળી અને કેપ્સુલ : ૨૫૦ મી.ગ્રા. અને ૫૦૦ મી.ગ્રા.<br/>સીરપ માટે પાવડર : ૨૦૦ મી.ગ્રામ પ્રતિ ૫ મીલી</p>  |
| <p><b>ક્યારે અને કેટલી માત્રામાં લેવી :</b></p>    | <p>જે સ્વીઓને જાતીય રોગ થવાનું જોખમ હોય તેમને માટે :<br/>૧ ગ્રામ એક જ સાથે મૌં વાટે લેવી.</p>  |
| <p><b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b></p>    | <p>દરીથ્રોમાયસીન અને મેકોલીડ જુથની બીજી દવાઓની એલર્જી હોય તેમણે ન લેવી.</p>  |
| <p><b>ઉપયોગી માહિતી :</b></p>    | <p>જમતાં પહેલાં ૧ કલાક અગાઉ કે જમ્યા બાદ ૨ કલાક પછી લેવી.<br/>જે જાતીય રોગો (STDs) માં પાક પડતો હોય કે ચાંદાં થતાં હોય તેમાં આ દવા ખૂબજ અસરકારક છે. જે જાતીય રોગોમાં બીજી દવાઓ અસરકારક નથી ત્યાં પણ તે અસરકારક છે.</p> |
| <p><b>આડઅસર :</b></p>    | <p>આડા, ઉબકા, ઉલ્ટી, પેટમાં દુઃખાવો</p>  |
| <p><b>બીજી ઉપયોગી દવાઓ :</b></p>  | <p>ઘોનિના ચેપ અને જાતીય રોગો માટે જુઓ પાન નં.<br/>જનનાંગો પર ચાંદાં માટે જુઓ પાન નં.</p>   |

|   |   |
|---|---|
| <p><b>એઝેડ્ટી</b><br/><b>AZT</b></p> <p>એઝેડ્ટી એઈડ્ઝની સારવારમાં તેમજ માતા તરફથી બાળકને HIV નો ચેપ ન મળે તે માટે વપરાય છે. આ દવા વાપરવામાં વિશેષ દેખરેખની જરૂર છે. માટે તેની હોસ્પિટલમાં નિષણાતની દેખભાળ નીચે જ આપવી જોઈએ. ઉપરાંત તે ધાણી મૌંધી અને દુર્લભ છે.</p> | <p>(Azidothymidine, Retrovir, Zidovudine)</p> |
|---|---|

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

**બેન્જાથીન પેનીસીલીન** (લોંગાસીલીન-Longacillin, પેનકોમ-Pencom, પેનીડિચુરા-Penidura)  
**Benzathine Penicillin**

પેનીસીલીન બેન્જાથીન એ પેનીસીલીન જૂથની દવા છે. એક વખત લીધા પછી આ દવાની અસર ઘણા હિવસો સુધી રહે છે. સીફીલીસ-ઉપદંશ, જનનઅંગો પર ચાંદાં, શ્વસનતંત્રને ચેપ, વગેરેમાં તે ઉપયોગી છે. તે સ્નાયુમાં ઈંજેક્શન દ્વારા અપાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઇંજેક્શન માટે પાવડર : ૬, ૧૨ અને ૨૪ લાખ યુનિટ્સ એક વાયતમાં

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



જનનઅંગો પર ચાંદાં, શરીરાતના સીફીલીસ, બળાત્કાર પછી સીફીલીસ ન થાય તે માટે : ૨૪ લાખ યુનિટ્સનું સ્નાયુમાં ફક્ત એકવાર ઇંજેક્શન આપવું.

સીફીલીસના બીજા કે ત્રીજા તખક્કામાં : ૨૪ લાખ યુનિટ્સનું સ્નાયુમાં દર અઠવાડિયે એકવાર એમ ત્રણ અઠવાડિયા માટે આપવું.

અન્ય ઉપયોગ : ઉપલા શ્વસનતંત્રનો ચેપ (ગળાનો ચેપ, કાન પાકવો, કાકડા પાકવા), ચામડીનો ચેપ (ચાંદાં, ગૂમડાં), ૧૨ લાખ યુનિટ ઇંજેક્શન દ્વારા એક જ વાર.

- રહ્યુમેટીક તાવમાં રોગને વધતો અટકાવવામાં ૧૨ લાખ યુનિટ્સ, દર ત્રીજા કે ચોથા અઠવાડિયે.

કોણો આ દવા  
ન લેવી જોઈએ :



પેનીસીલીન જૂથની એલર્જીવાળા દર્દીએ

ચેતવણી :



એલર્જી રીએક્શન આવે કે દર્દી બેભાન થાય તો તરત જ ખબર પડે તે માટે ધ્યાન રાખો. ઇંજેક્શન આપ્યા પછી ૩૦ મિનિટ સુધી ધ્યાન રાખવું જોઈએ. એડ્રીનાલીન ઇંજેક્શન, રીએક્શનની સારવાર માટે તૈયાર રાખવું.

બીજુ ઉપયોગી દવાઓ :

સીફીલીસ માટે : ડોક્સિસાયકલીન, ટેટ્રા સાયકલીન, ઠરીથ્રોમાયસીન



## પુસ્તકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

### બેન્જાઇલપેનીસીલીન

(બેન્જાઇલપેનીસીલીન-Benzylpenicillin, સોડિસીલીન-Sodicillin)

### Benzylpenicillin

બેન્જાઇલ પેનીસીલીન એ પેનીસીલીન જૂથની દવા છે. આ દવા ખૂબ ગંભીર ચેપ માટે ઉપયોગી છે. દા.ત. ગર્ભપાત પછીનો ચેપ

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઠિંજેકશન માટે પાવડર : ૫ લાખ અને ૧૦ લાખ યુનિટની વાયલ

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



ગર્ભપાત પછીનો ગંભીર ચેપ :  
૫૦ લાખ યુનિટ્સ સ્નાયુમાં એકજ વાર આપવી.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



પેનીસીલીન જૂથની એલર્જ્યવાળા દર્દીએ

ચેતવણી :



તેના એલર્જ્યક રીએક્શન અંગે ખાસ કાળજ રાખો.

અન્ય ઉપયોગો :

ગળાનો ચેપ, કાકડાનો ચેપ, કાન પાકવો, વરાધ, ચામડીનો ચેપ વગેરે  
૫-૧૦ લાખ યુનિટ્સ સ્નાયુમાં ઠિંજેકશન આપવું.  
દર છ કલાકે ૭ દિવસ માટે આપવું. ડિફ્યેરીયા કે ધનૂર માટે ભારે માત્રામાં  
૨૦ લાખ યુનિટ્સ દર ઉ કલાકે નસ વાટે




## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |  |
|--|--|
| <p><b>સેફિક્ઝાઇમ</b> (બાયોટેક્સ-ઓ-Biotax-O, સેફેલ-ઓ-Cefel-O,<br/>સેફસ્પાન-Cefspan, સેફટાસ-Ceftas, સુપ્રેક્સ-Suprax)</p>  |   |
| <p>સેફિક્ઝાઇમ એક જીવાણુનાશક દવા છે કે જે ધણા બધા ચેપોની સારવારમાં વપરાય છે જેવા કે ગોનોરિયા અને પેઢુમાં સોજ આવવાનો રોગ. આ સિવાય તે ગળાના ચેપમાં, કાકડાના ચેપમાં, ફેફસાના ચેપમાં, કાનના ચેપમાં અને પેશાબમાં પડું થયું હોય ત્યારે પણ વાપરી શકાય.</p> |  |
| <p>દવાનાં ઉપલભ્ય<br/>સ્વરૂપો :</p>   |  <p>ગોળીઓ ૧૦૦ mg અને ૨૦૦ mg<br/>પ્રવાહી ૫૦ mg / ૫ ml (સુકો પાઉડર)</p>   |
| <p>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>   |  <p>૨૦૦ કે ૪૦૦ mg - દિવસમાં<br/>(આ માત્રા એક વખત કે બે ભાગમાં લઈ શકાય)</p>  |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</p>  |  <p>જ્યારે કોઈને સીફ્લોસ્પોરોનથી એલર્જ<br/>હોય ત્યારે આ દવા ન લેવી.</p>   |
| <p>આડઅસરો :</p>  |  <p>ઉબકા આવવા, અતિસાર (ઝાડા),<br/>માથાના દુઃખાવો</p>  |
| <p>ચેતવણી :</p>  |  <p>એલર્જ થાય છે કે નહીં તેની તક્કદારી રાખવી<br/>જે વ્યક્તિને યકૃતમાં કોઈપણ જતનો રોગ હોય<br/>તેણે આ દવા બહુ સાવચેતીથી લેવી.</p> |
| <p>બીજું ઉપયોગી દવાઓ :</p>   | <p>ગોનોરીયા માટે - સેફિક્ઝાઇમ, સીપ્રોફ્લોકસાસીન, કોટ્રાયમોક્ઝેઝોલ,<br/>કેનામાયસીન, નોરફ્લોકસાસીન લઈ શકાય.<br/>પેઢુમાં સોજે હોય તો સેફિક્ઝાઇમ કે નોરફ્લોકસાસીન લઈ શકાય.</p>   |
| <p>દવા વધુ પડતી<br/>માત્રામાં લેવાઈ<br/>જય તો :</p>  |  <p>ઉબકા આવવા, ઉલ્ટીઓ થબી, ચામડી પાતળી થઈને ચીરા પડે કે<br/>લોહી પણ નીકળ</p>  |

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |  |   |
|---|--|---|
| <b>સેફ્ટ્રિયક્ઝોન</b><br><b>Ceftriaxone</b>   | (એક્ઝોન-Axone, સીફર-Cefar, સેફેક્ઝોન-Cefaxone, હેક્ઝોન-Haxone,<br>લાય્સેફ્ટ-Lyceft, મોનોસેફ-Monocef, ઓફ્રામેક્સ-Oframox, ટોરોસેફ-Torocef)  | <b>ચેતવણી</b><br>   |
| <p>સેફ્ટ્રિયક્ઝોન એ સીડેલોસ્પોરીન ગ્રુપમાંની એક બહુ જ મહત્વની દવા છે કે જેને સ્નાયુમાં ઠંડેકશનથી આપવામાં આવે છે. આ દવા ધળા ચેપોમાં આપી શકાય જેવા કે ગોનોરિયા કે પેટમું સોને આવવાનો રોગ. આ ઉપરાંત તે મૂત્રપિંડના ચેપમાં, ન્યુમોનિયામાં, ટાયફોઇડમાં કે પછી મગજના તાવમાં પણ આપી શકાય છે. સુવાવડ, કસુવાવડ કે પછી ગર્ભપાત પછી થતા ગંભીર ચેપોમાં પણ આ દવા આપી શકાય.</p> |  |   |
| <b>દવાનાં ઉપલબ્ધ</b><br><b>સ્વરૂપો :</b>  |  | ૧૨૫ mg    ૧ gm<br>૨૫૦ mg    ૨ gm    ની ઠંડેકશન માટે વાયલ<br>૫૦૦ mg  |
| <b>ક્યારે અને કેટલી</b><br><b>માત્રામાં લેવી :</b>  |  | <p>સુવાવડ પછી થતા ગંભીર પ્રકારના ચેપોમાં<br/>         ગોનોરિયા કે પેટના સોન્નનો રોગ માટે ૧ gm સ્નાયુમાં ૧૦ દિવસ<br/>         મેનીન્જનાઈટીસ (મગજનો તાવ) અને ટાયફોઇડ માટે પહેલાં દિવસે<br/>         ૪ ગ્રામ નસમાં - પછી<br/>         ૨ ગ્રામ નસમાં - દિવસમાં એકવાર ૧૦ દિવસ માટે</p> |
| <b>કોણે આ દવા</b><br><b>ન લેવી જોઈએ :</b>   |  | <p>જ્યારે કોઈને સીડેલોસ્પોરીન ગ્રુપની કોઈપણ લુવાણુનાશક દવાથી<br/>         એલર્જી હોય ત્યારે ન લેવી.</p>   |
| <b>ચેતવણી :</b>   |  | <p>એલર્જીને ધ્યાનમાં રાખો<br/>         જ્યારે પણ આ લુવાણુનાશક દવાને ઠંડેકશનના રૂપમાં આપવામાં આવે<br/>         ત્યારે એલર્જીની સારવાર માટેની દવાઓ તૈયાર રાખો.</p>  |
| <b>બીજું ઉપયોગી દવાઓ :</b>  | <p>ગંભીર પ્રકારના ચેપોમાં એમોક્સિસીલીન અને કલેવ્યુલેનીક એસીડનો<br/>         પોટેશિયમ ક્ષાર વાપરી શકાય.<br/>         ગોનોરિયા કે પેટમાં સોને આવવાના રોગમાં કેનામાયસીન વાપરી શકાય.</p> |   |



## પુષ્ટકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <p><b>સેફાલેક્સીન.</b></p> <p>(આલસેફીન-Alcephin, બ્લુસેફ-Blucef, સેફ-Cell, સીફેક્સીન-Cephaxin, ઓરિફેક્સ-Orifex, ફેક્સીન-Phexin, સેપેક્સીન-Spixin)</p> | <p>સીફાલેક્સીન પણ સીફાલોસ્પોરીન ગ્રુપની એક જીવાણુનાશક દવા છે. આ દવા સ્તનના ચેપો અને મૂત્રપિંડના ચેપમાં વાપરી શકાય. તે ઉપરાંત શ્વસનતંત્રના ચેપો, ચામડીના ચેપો દાતના ચેપો અને બીજા અનેક ચેપોમાં વાપરી શકાય છે.</p>   |
| <p><b>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :</b></p>   |  <p>ગોળી અથવા કેપસ્યુલ 250 mg, 375 mg, 500 mg, 750 mg<br/>પ્રવાહી 125 mg/5 ml, 250 mg/5 ml સ્લૂઝ પાવડર</p>  |
| <p><b>કયારે અને કેટલી માત્રામાં લેવી :</b></p>  |  <p>સ્તન કે મૂત્રપિંડના ચેપોમાં<br/>250 mg (મોટેથી) દિવસમાં ચાર વખત - ૧૦ દિવસ માટે<br/>અથવા ૩૦ થી ૫૦ mg/kg/દિવસ (કુલ માત્રા)<br/>(દિવસમાં આ કુલ માત્રાના ચાર સરખા ભાગ કરી ચારવાર આપવું)</p> |
| <p><b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b></p>  |  <p>જે સીફાલોસ્પોરીન ગ્રુપની કોઇપણ જીવાણુનાશક દવાની એલજી હોય તો ન લેવી.</p>  |
| <p><b>આડઅસરો :</b></p>  |  <p>ઉબકા,<br/>ઉલ્ટી,<br/>જવલ્લેજ જાડામાં લોહી પડે અને તાવ આવે.</p>  |
| <p><b>ચેતવણી :</b></p>  |  <p>એલજીથી સાવધાન રહો.</p>  |
| <p><b>ઉપયોગી માહિતી :</b></p>   |  <p>જે જાડામાં લોહી પડે અને તાવ આવે તો તરત આ દવા બંધ કરી મેટ્રોનિડ્ઝોલ શરૂ કરવી.</p>  |
| <p><b>બીજી ઉપયોગી દવાઓ :</b></p>  | <p>સ્તનના ચેપો અથવા ચામડીના ચેપો : એરીશ્રોમાયસીન, કલોક્સાસીલીન કે એમોક્સીસીલીન વાપરી શકાય.<br/>મૂત્રપિંડના ચેપમાં એમોક્સીસીલીન, કોટ્ટાયમોક્ઝોલ, એરીશ્રોમાયસીન કે નોર્ક્લોક્સાસીન વાપરી શકાય.</p>   |

### ચારકોલ

#### Charcoal

આ દવા ચારકોલ ઘણી દવાઓના પોઇઝનીગમાં લઈ શકાય - જેવી કે એસ્પીરીન, પેરાસીટામોલ, ફિનોબાળીટોન વગેરે - ઘણા બિલાડીના ટોપ પણ જેરી હોય છે તે લેવાઈ ગયા હોય તો પણ ચારકોલ લઈ શકાય.

આ દવાની કોઈ બનાવટ ભારતમાં મળતી નથી અને તેની અવેજુમાં બળોલા ટોસ્ટનો પાવડર વાપરી શકાય.

કેરોસીન, પેટ્રોલ જેવા પાણીથી હલકા પ્રવાહી લેવાયા હોય તો ચારકોલનો ઉપયોગ ન કરવો.

જે લોકોએ કોઈ પણ દવા કે કેરોસીન - પેટ્રોલ જેવી વસ્તુઓ લઈ લીધી છે, તેઓની તબિયત ગંભીર સમજુને તેમને તરત દવાખાને લઈ જવા. તેમને ફક્ત ચારકોલ કે ઘરગઢુ ઉપાયોને આશારે ધરમાં રાખવા નહિ.



## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |   |  |  |
|--|---|--|--|
| <b>કલોરેમફેનીકોલ</b><br><b>Chloramphenicol</b>   | (બાયોફેનીકોલ-Biophenicol, કલોરેમાયસેટીન-Chloromycetin,<br>પેરાક્સીન-Paraxin, રીકલોર-Reclor) |   |  |
| <p>આ એક બહુ અગત્યની જવાણુનાશક દવા છે કે જે સૂવાવડ-કસૂવાવડ કે ગર્ભપાત વખતના ગંભીર ચેપોમાં વાપરી શકાય. આ દવા ત્યારે જ વાપરવી જોઈએ કે જ્યારે બીજી ઓછી ખતરનાક દવાઓ યા તો કામ ન કરે અથવા બીજી દવાઓ લેવી સુરક્ષિત ના હોય. જે બીજા આંખના મલમ જેવા કે ટેટ્રાસાયકલીન કે એરીથ્રોમાયસીન ઉપલબ્ધ ના હોય તો આ દવાનો આંખનો મલમ પણ વાપરી શકાય.</p> |   |  |  |
| <b>દવાનાં ઉપલબ્ધ</b><br><b>સ્વરૂપો :</b>   |            | કેપસ્યુલ ૨૫૦ mg અને ૫૦૦ mg, ઈલેક્શન ૧ gm<br>પ્રવાહી ૧૨૫ mg / ૫ ml, આંખના ટીપા ૦.૫% અને ૧%<br>કાનના ટીપા ૫%, મલમ ૧%         |  |
| <b>ક્યારે અને કેટલી</b><br><b>માત્રામાં લેવી :</b>   |            | મોં વાટે : ૩૦-૫૦ mgm કિગ્રા./દિવસ - દિવસમાં ચાર વખત.<br>સરખા ભાગે લેવી.<br>ગંભીર ચેપમાં ૧ gm નસ દ્વારા દિવસમાં ચાર વખત     |  |
| <b>કોણે આ દવા</b><br><b>ન લેવી જોઈએ :</b>  |          | ગર્ભવતી સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ   |  |
| <b>આડઅસરો :</b>  |          | પેટમાં સારુ ન. લાગે અને બરાબર ના હેખાવું   |  |
| <b>ચેતવણી :</b>  |          | શક્ય હોય ત્યાં સુધી બીજી જવાણુનાશક દવાનો ઉપયોગ કરવો.<br>રક્તને કાયમી નુકશાનની સંભાવના છે -<br>કોઈ વખત તો મૃત્યુ પણ થઈ શકે. |  |
| <b>ઉપયોગી માહિતી :</b>   |          | <b>નજીવ</b>  | <b>અન્ય ઉપયોગો :</b><br>જન્મ પછી માતાને થતા ગંભીર<br>પ્રકારના ચેપો<br>ગર્ભપાત પછી નાના બાળકની આંખની<br>સંભાળ/સારવાર માટે ટેટ્રાસાયકલીન કે<br>એરીથ્રોમાયસીનનો આંખનો મલમ વધારે<br>સારો છે. |
| <b>દવા વધુ પડતી</b><br><b>માત્રામાં લેવાઈ</b><br><b>જથું તો :</b>  |          | નજીવી બાબતમાં ઉત્તરડા પડે<br>અને લોહી પણ નીકળી શકે.<br>દ્રષ્ટિની ખામીનો અનુભવ થાય.   |  |

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |   |
|--|---|
| <b>સીપ્રોફ્લોક્સાસીન<br/>Ciprofloxacin</b>   | <p>(એબેક્ટ-Abact, સીફ્રાન-Cifran, સીલોક્સ-Ciplox, સીપ્રોબિડ-Ciprobid,<br/>સીપ્રોઇડ-Ciproidac, સીપ્રોફ્લોક્ઝાસીન-Ciprofloxacin, સીપ્રોવીન-Ciprowin,<br/>ફ્લોસી-Floxy, પેંગીના-Pinguina, ક્વીન્ટોર-Quintor)</p>   |
|  |    |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>           |  <p>ગોળીઓ - 250 mg, 500 mg અને 750 mg<br/>બાટલાઓ - 100 ml (2mg/ml)<br/>આંખમાં નાખવાના ટીપા/કાનમાં નાખવાના ટીપા - 0.3%<br/>મલમ - 0.3%</p>   |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b> |  <p>ગોનોરિયા/પેઢુનો સોને/શેંકોઈઠ - 500 mg એક જ વાર<br/>મૂત્રપિંડના ચેપ દિવસમાં બે વાર 10 દિવસ માટે<br/>બીજા ચેપો જેવા કે આંતરડાના ચેપ, ત્વચામાંના ચેપ, ટાઇફોઈનો<br/>તાવ અને સાંધામાં થતા ચેપો માટે - 500 થી 750 mg<br/>દિવસમાં બે વાર, એકથી બે અઠવાડિયા સુધી</p> |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>          |  <p>સગર્ભા સ્ત્રી, ધાત્રી માતા અને 16 વર્ષથી નીચેના બાળકો</p>  |
| <b>આડઅસરો :</b>                              |  <p>ઉબકા, ઝાડા, ઉલ્લી, માથાનો હુદાબાબો</p>   |
| <b>ચેતવણી :</b>                              |  <p>આ દવા કોઝી, ચોકલેટ કે કોલા-પીણામાં રહેલા કેફીન જેઠે પ્રક્રિયા કરે છે<br/>અને તેથી કેફીન વધુ સક્રિય બની શકે છે.<br/>આ દવાને ડેરીમાં બનતા ખાદ્યપદ્ધર્થો સાથે ન લેવી.</p>   |
| <b>ઉપયોગી માહિતી :</b>                       |  <p>ખૂબ પાણી પીઓ.<br/>ગમે તે ખાઈ શકાય પણ ડેરીમાં બનતા ખાદ્યપદ્ધર્થો ન લેવા.</p>  |
| <b>બીજી ઉપયોગી દવાઓ :</b>                    | <p>ગોનોરિયા માટે - સેફ્રાયક્ઝોન, કેનામાયસીન, નોર્ફલોક્સાસીન<br/>શેંકોઈઠના ચેપ માટે - એરીથ્રોમાયસીન કે કોટ્રાયમોક્ઝોલ<br/>પેઢુના સોન માટે - નોર્ફલોક્સાસીન, ડોક્સિસાયક્લીન, મેટ્રોનીટ્ઝોલ<br/>મૂત્રપિંડના ચેપ માટે - એમોકસીસીલીન, કોટ્રાયમોક્ઝોલ</p>   |

## પુષ્ટકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી


|  |  |
|--|--|
| <b>ક્લોટ્રાયમેઝોલ</b><br><b>Clotrimazole</b> | ફૂગને લીધે થતા મોઢા, ગળા અને ચોનિમાર્ગના ચેપમાં આ દવા વપરાય છે. આ દવા ચામડીના ફૂગથી થતા રોગોમાં પણ વાપરી શકાય.   |
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો :                   |  <p>યોનિમાર્ગમાં મૂકવાની ગોળી 100 mg, 200 mg &amp; 500 mg<br/>મલમ 1%<br/>મૌંબાં ચૂસવાની ગોળી 10 mg</p>  |
| કથારે અને કેટલી<br>માત્રામાં લેવી :          |  <p>યોનિમાર્ગના ચેપ માટે<br/>500 mg ની ગોળી ફક્ત રાતે-સૂતી વખતે એક જ વાર મૂકવી.<br/>100 mg ની 2 ગોળીઓ રાતે-સૂતી વખતે મૂકવી. (ત્રણ રાત માટે)<br/>મલમ 5 gm યોનિમાર્ગમાં મૂકવો-રાતે સૂતી વખતે - 7 થી 14 દિવસ માટે<br/>મોઢા અને ગળાના ચેપ માટે - ચૂસવાની ગોળી દિવસમાં 4 વાર લેવી<br/>- 14 દિવસ માટે</p> |
| કોણે આ દવા<br>ન લેવી જોઈએ :                  |  <p>જે કોઈ વ્યક્તિને આ દવાથી એલર્જી થતી હોય તો આ દવા ન લેવી.</p>  |
| આડઅસરો :                                     |  <p>સાધારણ બળતરા, ખંજવાળ,<br/>ઉબકા/ઉલ્ટી - જે મોઢાથી લેવામાં આવે તો જ</p>   |
| ચેતવણી :                                     |  <p>જે આ દવા મૂકવાથી યોનિમાર્ગમાં બળતરા થતી હોય તો દવા વાપરવાની<br/>બંધ કરવી. ત્રણ-ચાર દિવસ માટે સંભોગ ન કરવો નહીં તો સામી વ્યક્તિને<br/>ચેપ લાગવાની સંભાવના છે.</p>  |
| ઉપયોગી માહિતી :                              |  <p>સગર્ભા સ્ત્રીઓ માટે એક જ ડોઝ - વધારે માત્રામાં - સારું કામ આપે છે.</p>  |
| બીજું ઉપયોગી દવાઓ :                          | <p>ફૂગના ચેપ માટે : નીસ્ટેટીન, માઇકોનેઝોલ, જેન્શન વાયોલેટ (જમલી દવા)<br/>કે પણી સરકો<br/>એટિડસન્ના ફર્ટીઓમાં - કિટોકોનેઝોલ</p>   |

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

| કોડીન.  | (કોડીન લિંકટ્સ-Codeine Linctus, કોડીન સલ્ફેટ-Codeine Sulphate, લિંકોટ્સ-Lincotus, મોન્ટોકુગ-Montokug)  | ચેતવણી  |
|---|--|---|
| કોડીન એ ઓપિયેટ (અફીણ) ગુપની દર્દશામક દવા છે જે ઉધરસ ઓઇચી કરે છે અને એવી શાંતિ આપે છે કે વ્યક્તિ સૂઈ જાય. ઉધરસના કારણની પૂરતી સારવાર કર્યા બાદ પણ જે ઉધરસ રહે તો તેવી ઉધરસ ઓઇચી કરવા કોડીન વપરાય છે. કોઈપણ પ્રકારના દર્દ માટે જ્યારે બીજી બધી દર્દશામક દવાઓ નિષ્ફળ નીવઠે ત્યારે જ કોડીન વાપરવી. આ દવા (૧૨ વર્ષથી વધુ ઉંમર માટે) જાડામાં પણ વાપરી શકાય. |  |  |
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો :  | <br>પ્રવાહી 15 mg/5 ml<br>ગોળીઓ 15 mg, 30 mg, 60 mg<br>ઉધરસ માટેનું પ્રવાહી (કફસિરપ)  |   |
| ક્યારે અને કેટલી<br>માત્રામાં લેવી :  | <br>ઉધરસ માટે - જ્યારે જરૂર હોય ત્યારે ઇ થી ૧૫ mg<br>(વધુમાં વધુ દિવસમાં ચાર વખત)   |   |
| આડઅસરો :  | <br>બંધકોશ, થોડો સમય માટે પેશાભ કરવામાં પણ મુશ્કેલી થાય,<br>ઉંભા, ઉલ્ટી, ખંજવાળ, માથાનો દુઃખાવો                                 |   |
| ઉપયોગી માહિતી :   | <br>કોડીનથી આદત પડી જવાનો ભય રહે<br>જે તેનો ઉપયોગ વધારે દિવસ માટે કરવામાં આવે તો તેની અસર<br>આવવા માટે વધુ અને વધુ માત્રા જોઈએ. |   |
| દવા વધુ પડતી<br>માત્રામાં લેવાઈ<br>જય તો :  | <br>વધારે ઉંઘ આવવી, ધેન ચડવું, બેભાનાવસ્થા થવી  |   |
| દવા વધુ પડતી<br>માત્રામાં લેવાઈ<br>જય તો :  | વધારે પડતી લેવાઈ ગઈ હોય તો નેલોક્ઝોનનું ઠંડેકશાન આપી શકાય.<br>પણ તાત્કાલિક તબીબી મદદ માટે દવાખાને જાઓ.   |   |
| બીજી ઉપયોગી દવાઓ :  | સામાન્ય દુઃખાવા માટે એસિટિમાઇનોફેન (પેરાસિટિમોલ) કામ કરી શકે છે.<br>ખૂબ વધારે દુઃખાવા માટે મોરફીન લઈ શકાય.<br>ખાંસી દબાવવા માટે ખૂબ પાણી પીવું અને ધરણથું દવાઓ કરવી.   |   |

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

**કો-ટ્રાયમોક્ઝોલ** (બેક્ટ્રિમ-Bactrim, સીપ્લિન-Ciplin, ઓરિપ્રિમ-Oriprom, સેપમેક્સ-Sepmax, સેપ્ત્રન-Septran)



આ જીવાળાણુનાશક દવા એ બે ઘટકોનું સંયોજન છે, જેમાંની એક સલ્ફા ગ્રૂપની છે. આ દવા મૂત્રપિંડના ચેપોમાં વાપરી શકાય. તે ઉપરાંત એનો ઉપયોગ યોનિમાર્ગમાં થતા ચેપમાં પણ થાય છે. (ચેપ જે ગોનોરિયાના જીવાળાઓથી થાએલો હોય) જે એઠિડસની બિમારી હોય તો આ દવા તેમાં થતા જાડા અને ન્યુમોનીઓને અટકાવવામાં મદદ કરે છે. તે ઉપરાંત ખસનતંત્રના ચેપો, પેટ કે આંતરડાના ચેપો, ત્વચાના ચેપો, ટાઇફોઇડનો તાવ વગેરેમાં પણ તે વાપરી શકાય.

|                            |  |  |
|----------------------------|--|--|
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો : |  | ગોળી<br>480 mg (80 mg ટ્રાયમિથોપ્રિમ + 400 mg સલ્ફામિથોક્ઝોલ)<br>960 mg (160 mg ટ્રાયમિથોપ્રિમ + 800 mg સલ્ફામિથોક્ઝોલ)<br>પ્રવાહી (40 mg ટ્રાયમિથોપ્રિમ + 200 mg સલ્ફામિથોક્ઝોલ / 5 ml) |
|----------------------------|--|--|

|                                     |  |
|-------------------------------------|--|
| કચારે અને કેટલી<br>માત્રામાં લેવી : | મૂત્રશયના ચેપ : 480 mg ની 4 ટીકડીઓ ફક્ત વાર લેવી.<br>મૂત્રપિંડના ચેપ : 480 mg ની 2 ટીકડીઓ, દિવસમાં બે વાર 10 દિવસ સુધી<br>યોનિમાર્ગના ચેપ : 480 mg ની 12 ટીકડીઓ, દિવસમાં એક વાર 3 દિવસ સુધી<br>એઠિડસના દર્દીમાં જાડા અને ન્યુમોનીયા અટકાવવા :<br>480 mg ની એક ટીકડી રોજ લેવી. અથવા 480 mg ની બે ટીકડીઓ અટકાવવામાં બે વાર<br>એઠિડસના દર્દીમાં લોહિવાળા જાડા કે ન્યુમોનીયાની સારવાર માટે :<br>480 mg ની બે ટીકડીઓ દિવસમાં બે વાર, 10 દિવસ સુધી<br>પેટુંથી થતા સોજા કે શેંક્રોઇડ માટે :<br>480 mg ની 5 ટીકડીઓ દિવસમાં બેવાર, ત્રણ દિવસ માટે જે આ સારવારથી બહુ<br>ઉંફા આવતા હોય તો 480 mg ની બે ટીકડીઓ દિવસમાં બે વાર, 7 દિવસ માટે |
|-------------------------------------|--|

|                             |  |   |  |                                  |
|-----------------------------|--|---|--|----------------------------------|
| કોણે આ દવા<br>ન લેવી જોઈએ : |  | ગર્ભવતી ક્વીઓ સુવાતુના છેલ્લા<br>ત્રણ મહીના દરમિયાન જે સલ્ફાથી<br>એલર્જી થતી હોય તો આ દવા ન લેવી. | દવા વધુ પડતી ઉંફા<br>માત્રામાં લેવાઈ ઉલ્ટી<br>જય તો : જાડા | ઉંફા<br>મુંજવણ થવી<br>પરસેવો થવો |
|-----------------------------|--|---|--|----------------------------------|

|          |  |  |  |                                 |
|----------|--|--|--|---------------------------------|
| આડઅસરો : |  | ઉંફા, ઉલ્ટીઓ, જે ચામડી પર ચકામા થાય કે<br>અંજવાળ આવે તો આ દવા લેવાની બંધ કરવી.<br>(આવું એલર્જીના કારણે થતું હોય છે.) | દવા વધુ પડતી ઉંફા<br>માત્રામાં લેવાઈ જય તો :<br><br> | પુઞ્ચળ<br>પ્રમાણમાં<br>પાણી લો. |
|----------|--|--|--|---------------------------------|

|                    |   |  |
|--------------------|---|--|
| બીજુ ઉપયોગી દવાઓ : | મૂત્રશય કે મૂત્રપિંડના ચેપ માટે :<br>અંમોકસીસીલીન, નાઈટ્રોફ્યુરેન્ટોઇન, નોર્ફલોક્સાસીન<br>ગોનોરિયાના ચેપ માટે : સેફ્ટ્રાયોક્ઝોન, કેનામાયસીન, નોર્ફલોક્સાસીન<br>શેંક્રોઇડના ચેપ માટે : સીપ્રોક્લોક્સાસીન, સેફ્ટ્રાયોક્ઝોન, એરીક્રોમાયસીન, કેનામાયસીન<br>એઠિડસના દર્દીમાં થતા જાડા માટે : નોર્ફલોક્સાસીન, મેટ્રોનીડ્જોલ |  |
|--------------------|---|--|

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### ડેક્સામિથેઝોન dexamethasone

(ડેકફોર્ટ-Daca Forte, ડેક્ઝોના-Dexona, ઈડીજોન-Idiazone, વાયમેસોન-Wymesone)

એલર્જના લીધે થતા શોકની સારવારમાં આ દવા કે જે એક સ્ટીરોઇડ છે, તે વપરાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ગોળીઓ : 0.5 mg, 1 mg  
ઢેંજેકશન 8 mg અને 20 mg.  
આંખમાં નાખવાના ટીપા  
કાનમાં નાખવાના ટીપા

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



એલર્જમાં થતા શોક માટે :  
20 mg નું ઢેંજેકશન તરત આપવું. જે ફરી ચિહ્નનો દેખાય તો  
20 mg ની ટીકડીઓ આપવી અને જરૂર પડે તો એકવાર ફરીથી  
પણ આપી શકાય.

આઈઅસરો :



જે દર્દીને ડાયાબીટીસ હોય તો આ દવા તેને થોડા કલાકો માટે બહુ  
ખરાબ અસર પહોંચાડી શકે.  
આ દવાથી જલદ પ્રેશર પણ વધી શકે.

બીજું ઉપયોગી દવાઓ :

એલર્જને લીધે જે શોક જેવી પરિસ્થિતિ ઉભી થાય તો હાઇડ્રોકોઈન્સોન  
આપી શકાય.



## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |   |   |   |  |   |
|---|---|---|---|--|---|
| <b>ડાયજેપામ</b><br>diazepam   | (કાલ્મોડ-Calmmod, કાલ્પોઝ-Calmpose,<br>વેલીયમ-Valium, પેક્સમ-Paxum)   |    | <b>ચેતવણી</b>   |  |   |
| <p>આ દવા શાંતિદાયક છે અને તે તાણ કે ખેંચની સારવારમાં વપરાય છે. આ દવાથી ચિંતા ઓછી થાય છે અને તે ઉંઘ લાવવામાં મદદ કરે છે. પ્રસુતિમાં કે ધનુરથી જ્યારે ખેંચ આવે ત્યારે પણ આ દવા ઉપયોગી થાય છે. તે ઉપરાંત જ્યારે સ્નાયુઓ સખત થઈ જઈનેદુઃખાવો આવે ત્યારે પણ આ દવા વાપરી શકાય.</p> |   |   |   |  |   |
| <b>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :</b>  |    | 5 mg & 10 mg & 2 mg (ટીકડીઓ)<br>ઈલેક્શન 5 mg/ml ઈલેક્શન   |   |  |   |
| <b>ક્યારે અને કેટલી માત્રામાં લેવી :</b><br>  | <p>ખેંચ/તાણ માટે : 20 mg ગુદાકારે આપવી - ફક્ત ઈલેક્શન વાપરવું.<br/>         સોય વિના જરૂર લાગે તો ફરીથી આપી શકાય. ઈલેક્શનના ઢિપમાં ડાયજેપામ નામલે તો ટીકડીઓને ભાંગીને પાણીમાં નાખી વાપરવું.<br/>         દાડ છોડતી વખતે આવતી તાણને અટકાવવા : 10 mg કે 20 gm ની ટીકડીઓ લેવી.<br/>         જરૂર લાગે તો એક કલાક પછી ફરીથી આપવી. જે તે પછી પણ જરૂર જણાય તો દર 4 થી 5 કલાકે ગોળી આપવી અને તબીબી સહાય મેળવવા સરળ કરવી.<br/>         અનિદ્રા કે ચિંતા માટે : 2.5 mg કે 5 mg ની ટીકડીઓ</p> |   |   |  |   |
| <b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b>   |    | સગર્ભા ક્રી અને ધાત્રીઓએ આ દવા ગંભીર સ્થિતિ (ઇમરજન્સી) થાય તો જ લેવી.   |   |  |   |
| <b>આડઅસરો :</b>   |    | <p>સગર્ભાવસ્થાના સમય દરમિયાન જે આ દવા વધુ માત્રામાં કે વારંવાર લેવામાં આવે તો બાળકને શારીરિક ખોડ-ખાંપણ થવાની શક્યતા છે.</p> | <b>દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જય તો :</b>   |  | દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જય તો : ધેન ચઢવું,<br>સ્થિર રહેવામાં મુશ્કેલી ગુંચવણ |
| <b>ચેતવણી :</b>   |    | <p>આ દવાની આદત પડી શકે. બીજી દવાઓ કે જે ધેન લાવી શકે તેની સાથે તો આ ન જ લેવી; ખાસ કરીને દાડ જોડો.</p>                       | <b>બીજી ઉપયોગી દવાઓ :</b>   |  |   |
| <b>ઉપયોગી માહિતી :</b>  |    | <p>આ દવા દર્દશામક નથી. અને તેનાથી આદત પડી શકે છે.</p>   | તાણ માટે - મેળેશિયમ સલ્ફેટ<br>ઉંઘ લાવવા - ડાયફ્રિન હાઇડ્રોમાઈન<br>ચિંતા હરવા - હાયટ્રોક્સીઝિન |  |   |

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### કલોક્સાસિલીન

(બાયકલોક્સ-Biclo, ક્લોક્સ-Clox)

#### cloxacillin

આ એક લ્લવાળુનાશક દવા છે. જે પેનિસીલીન ગ્રુપની છે. આનો મુખ્ય ઉપયોગ ચામડીના અને સ્તનના ચેપોની સારવારમાં થાય છે. સ્ટેફીલોક્સ ઓરીયસથી થતા ચેપોમાં પણ તેવાપરી શકાય.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



કેપસ્યુલ : 250 mg, 500 mg  
ફિલેક્શન : 250 mg અને 500 mg.

કયારે અને કેટલી  
માત્રામાં લેવી :



250 થી 500 mg, દિવસમાં 4 વખત 7 થી 10 દિવસ માટે  
30-50 mg/kg, દિવસનો કુલ ડોઝ - 4 સરખા ભાગમાં આપવો.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



જે પેનિસીલીનની એલર્જી હોય તો આ દવા ન લેવી.

આડઅસરો :



ઉંફા, ઉલ્ટી, જાડા

ચેતવણી :



એલર્જીના ચિનહોએ કે શાક જેવી હાલત થાય તેનું ધ્યાન રાખવું.

બીજું ઉપયોગી દવાઓ : એમોક્સિસીલીન, સિફ્લેક્સીન, એરીશ્ટોમાયરીન



## પુષ્ટકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <p><b>ડાયફિનહાયડ્રોમાઈન હાયડ્રોક્લોરોઇડ</b> (બેનાડ્રિલ-Benadryl)<br/><b>diphenhydramine hydrochloride</b></p> <p>આ એક એન્ટીહિસ્ટામીન દવા છે જે નાકમાંના પ્રવાહીને સૂક્કવી હો છે અને ધેન લાવી હો છે. જે લોકોને એઠિડ્સ થયો હોય તે વ્યક્તિઓમાં ઘણા વખતની જૂની ખંજવાળ અને ઉંધની તકલીફોની સારવારમાં વપરાય છે. એલર્જીથી થતા રોગો અને એલર્જીથી થતા શ્રોકમાં પણ એ વાપરી શકાય. એલર્જીને લીધે થતી ઉધરસ ઓછી કરવામાં પણ તે બહુ ઉપયોગી છે.</p> <p><b>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો:</b></p>  <p>ગોળીઓ/કેપસ્યુલ : 25 mg અને 50 mg<br/>પ્રવાહી : 12.5 mg/5 ml<br/>દિંજેક્શન : 10 mg કે 30 mg કે 50 mg એક ml માં</p> | <p><b>ચેતવણી</b></p>                      |
| <p><b>ક્યારે અને કેટલી માત્રામાં લેવી :</b></p>  <p>એલર્જ અને ખંજવાળ માટે : 25 mg ની દીકરી દિવસમાં 3 થી 4 વાર (જરૂર પ્રમાણે)<br/>ઉંધની તકલીફ માટે : 25 mg કે 50 mg - સૂતી વખતે<br/>એલર્જીથી થતો શ્રોક :<br/>50 mg નું દિંજેક્શન સનાયુમાં તરત આપવું. 8 કલાક પછી ફરી તે આપી શકાય.<br/>જરૂર લાગે તો એનાથી પહેલા પણ આપી શકાય.</p>   |  |
| <p><b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b></p>  <p>સગભર્ણ સ્વીઓ અને ધાત્રી માતાઓએ આ દવા એલર્જની સારવારમાં લાંબો સમય ન લેવી જોઈએ. દમના દર્દીઓએ ના લેવી.</p>   |  |
| <p><b>આડઅસરો :</b></p>  <p>ધેન ચઢવું, મોઢું સુકાવું, કોઈવાર તે ઉભકા અને ઉલ્ટીઓ પણ લાવી શકે,<br/>જવલ્લેજ એ એની અસર કરતાં એકદમ ઉંધી અસરો કરે છે અને<br/>શરીરને શાંત કરવાની જરૂરાએ તે શરીરને ઉતેજાત કરી મૂકે.</p>   |  |
| <p><b>ચેતવણી :</b></p>  <p>સર્કિય કે સાવધાન રહેવું હોય તો આ દવા ન લેવી.<br/>(દા.ત. ડ્રાઇવિંગ પહેલા, મશીન પર કામ કરતાં),<br/>મગજને શાંત કરનારી દવાઓ અને દાઢની અસરો બહુ જ વધારી હો.</p>  |  |
| <p><b>ઉપયોગી માહિતી :</b></p>  <p>આ દવાનું દિંજેક્શન ફક્ત ખૂબ વધારે એલર્જમાં કે શ્રોકમાં જ આપવું.</p>  | <p><b>બીજી ઉપયોગી દવાઓ :</b></p> <p>એલર્જ માટે :</p> <p>હાયડ્રોક્સિજીન<br/>પ્રોમેથાજીન<br/>ઉંધવા માટે :</p> <p>ડાયાઝેપામ</p> |

## પુસ્તકમાં સ્વુચ્છવેલી દવાઓ વિશે માહિતી

|   |  |  |
|---|--|--|
| <p><b>ડોક્સિસાયકલીન</b> (બાયોડોક્સી-Biodoxy, ડોક્સી-1-Doxy-1, એલ.એ.એ.-L.A.A., મીનિસાયકલીન-Minicycline, વાઈવોસાયકલીન-Vivocycline)</p>  |   |  |
| <p>આ ટેટ્રાસાયકલીન ગ્રુપની જીવાણુવિરોધક દવા છે. આનો મુખ્ય ઉપયોગ સંભોગથી થતા ચેપો, પેઢુમાં થતા ચેપો અને ગર્ભપાત પછી થતા ચેપોની સારવારમાં છે. આ ઉપરાંત ટ્રેકોમા (ાંખના ખીલ), આંખના બીજા ચેપો, શ્વસનતંત્રના ચેપો, દાંતના ચેપો વગેરેમાં વાપરી શકાય.</p> |  |  |
| <p>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</p>  |  <p>ટીકડીઓ/કેપસ્યુલ : 50 mg, 100 mg અને 200 mg<br/>પ્રવાહી (સુકો પાવડર) : 25 mg/5 ml, 50 mg/ml</p>  |  |
| <p>કચારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>   | <p>યોનિમાંથી નીકળતું પ્રવાહી (સંભોગથી થતા રોગ સ્વુચ્છ થતે) 100 mg ની ટીકડીઓ,<br/>દિવસમાં 2 વાર 7 દિવસ માટે<br/>સિફીલિસ માટે : 100 mg દિવસમાં 2 વાર 15 દિવસ માટે<br/>જૂના સિફીલિસ માટે : 100 mg દિવસમાં 2 વાર 25 દિવસ માટે<br/>પેઢુના ચેપો માટે : 100 mg દિવસમાં 2 વાર 10 દિવસ માટે<br/>ગર્ભપાત પછીના ચેપ અટકાવવા કે પછી સંભોગથી થતા રોગો અટકાવવા<br/>100 mg દિવસમાં 2 વાર 5 દિવસ માટે<br/>ગર્ભપાત પછીના ચેપોની સારવારમાં : 100 mg દિવસમાં 2 વાર 10 દિવસ માટે</p> |  |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</p>   |  <p>સગર્ભા સ્ત્રીઓ અને ઘાતી માતાઓ,<br/>આઠ વર્ષથી ઓછી ઉમરના બાળકો<br/>(ડોક્સિસાયકલીનથી બાળકોના દાંત અને હાડકાઓમાં ક્ષતિ ઉત્પન્ન થઈ શકે)</p>  |  |
| <p>આડઅસરો :</p>   |  <p>જાડા, પેટમાં સારું ન લાગવું,<br/>કયારેક - સૂરજના તડકામાં ચામડી પર ચાડા ઉપસી આવવા</p>  |  |
| <p>ચેતવણી :</p>   |  <p>સગર્ભાસ્ત્રીઓ અને ઘાતી માતાઓએ ન લેવી.<br/>જૂની દવા ન લેવી<br/>દૂધ કે દૂધની બનાવટો સાથે ન લેવી<br/>એન્ટાસીઝની દવા (પેટમાં બળતરા માટે વપરાતી) સાથે ન લેવી.</p>  |  |
| <p>ઉપયોગી માહિતી :</p>  |  <p>સૂતા સૂતા આ ગોળી ન લેવી બેઠા<br/>રહીને આ ગોળી લેવી અને સાથે<br/>ઘણું બધું પાણી પીવું<br/>(આમ કરવાથી ગળામાં થતી<br/>બળતરા અટકાવી શકાય છે.)</p>   | <p>બીજી ઉપયોગી દવાઓ :</p> <p>સિફીલિસ માટે : બેન્જાથીન પેનિસીલિન<br/>ગોનોરિયા માટે : કો-ટ્રાયમોક્લેરોલ<br/>કલાઇમેડીયાના ચેપ માટે : એરીથ્રોમાયસીન<br/>ગર્ભપાત પછીના ચેપ અટકાવવા : એમોક્સિસીલીન</p> |

## પુષ્ટકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી

**એપીનેફ્રીન / એડ્રેનાલીન** (એડ્રેનાલીન ટર્ટારેટ-Adrenaline Tartrate)  
**epinephrine or adrenaline**

એપીનેફ્રીન અને એડ્રેનાલીન એક જ દવાના બે નામ છે. આ દવા એલજીમાં વાપરી શકાય. પેનીસીલીન થતી એલજી અને શૉકમાં પણ દવાનો ઉપયોગ થાય છે. ઘણી વખત સખત દમના હુમલામાં પણ આ દવા વપરાય છે, જે કે દમમાં વપરાતી દવા - સાલ્ફ્યુટેમોલથી પણ રાહત ના મલે તો જ આ દવા વાપરવામાં આવે છે. કોઈપણ કારણસર જયારે હૃદય ધબકવાનું બંધ કરી દેતો આ દવા વાપરી શકાય.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઠંલેકશન : 1 mg / 1 ml

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



દમ કે એલજી માટે :  
1/2 મીલીનું ઠંલેકશન, ચામડીની નીચે આપવું (સનાયુમાં નહીં)  
આ ઠંલેકશન બાવડામાં આપવામાં આવે છે. જે જરૂર જણાય તો  
20 થી 30 મીનિટ પછી આ જ માત્રામાં ફરી ઠંલેકશન આપવું.  
ત્રીજી વાર પણ આ ઠંલેકશન આજ માત્રામાં - ફરી 20 થી 30 મીનીટ  
પછી આપી શકાય. (બીજી દવાઓ પણ જરૂર પડે તો આપવી)

આડઅસરો :



બીક લાગવી, ગભરામણ, શાંત બેસી ન શકાય, ચિંતા,  
માથાનો દુઃખાવો, ચક્કર આવવા, હૃદયના ધબકારા વધી જવા

ચેતવણી :



જણાવ્યા પ્રમાણેની માત્રામાં જ આ દવા આપવી.  
આ ઠંલેકશન થાપામાં ન આપવું. હાથના ઉપરના ભાગમાં  
(બાવડામાં) જ આપવું.

ઉપયોગી માહિતી :



દર્દીની નાડીના ધબકારા ઠંલેકશન આપતા પહેલા માપી લેવા.  
ત્રણ વખત કરતાં વધારે વાર આ દવા ન આપવી.  
પહેલી વખત દવા આપ્યા પછી, જે નાડીના ધબકારા એક મિનીટમાં  
30 કરતાં વધુ વધી જય, તો દવા બીજીવાર ન આપવી.

દવા વધુ પડતી  
માત્રામાં લેવાઈ  
જય તો :



લોહીનું દબાણ વધી જય.  
હૃદયના ધબકારા વધે  
સ્ટ્રોક (લકવો થઈ જય).

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### અર્ગોમેટ્રીન મેલીએટ ergometrine maleate

(અર્ગેજીવ-Ergagin, લેરીન-Lerin, મીથર્જન-Methergin  
ભારતમાં મળતી નથી. તેના બદલે Methylegometrine Malate મળે છે.)

આ દવા ગર્ભાશયના તેમજ રક્તવાહિનીઓની અંદરના સ્નાયુઓનું સંકોચન કરે છે અને તે સુવાવડ કે ગર્ભપાત પછી થતા રક્તસ્વાવને અટકાવવા વપરાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



દીકરીઓ : 0.125 મિ.ગ્રા.

ફીજેક્શન : 0.2 મિગ્રા./મિલી

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



સુવાવડ પછી થતા ભારે રક્તસ્વાવ માટે :

ગર્ભપાત પછી થતા અતિશય રક્તસ્વાવ માટે :

આડઅસરો :



ઉંઘા આવવા, ઉલ્ટી થવી, ચક્કર આવવા, પરસેવો થવો,

ચેતવણી :



આ દવા સુવાવડ શક્ત કરવા ન વાપરવી.

બાળક અને ઓર ગર્ભાશયમાંથી બહાર આવે તે પહેલાં

આ દવા ક્યારે પણ ન આપવી.

ઉપયોગી માહિતી :



ગર્ભપાત કરવા આ દવા ન જ વાપરવી કારણકે તેમ કરવાથી ગર્ભપાત થયા પહેલાં માતાનું મૃત્યુ થઈ શકે છે.

બીજુ ઉપયોગી દવાઓ :

ઓક્સિટોસીન



## પુષ્ટકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |  |
|--|--|
| <p><b>એરીથ્રોમાયસીન</b></p> <p>(આલથ્રોસીન-Altrocin, EES-400, એલટ્રોસીન-Eltrocin, એરીથ્રોસીન-Erythrocin, ઈટોમીન-Etomin, થ્રોમાઇસીન-Thromycin)</p> | <p>મેઝોલાઇટ વિભાગની આ એક જીવાણુનાશક દવા છે જે ધણા બધા ચેપોની સારવારમાં વાપરી શકાય. ઉદા. સંભોગને લીધે થતા ચેપો, શ્વસનચંત્રના ચેપો, ત્વચામાં થતા ચેપ વગેરે. આ દવા ગર્ભવતસ્થામાં આપી શકાય છે.</p>   |
| <p>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</p>                              | <p>દીકરીઓ/કેપસ્યુલ : 100 મિગ્રા, 125 મિગ્રા, 250 મિગ્રા, 500 મિગ્રા<br/>પ્રવાહી : 125 મિગ્રા/5 મિલી (60 મિલી)<br/>લોશન/કીમ : 2% થી 4%</p>  |
| <p>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>                   | <p>મૂત્રાશયના ચેપ કે કલાઇમેરીયાના ચેપમાં :<br/>500 મિગ્રા ની દીકરી, દિવસમાં 4 વખત, 7 દિવસ માટે<br/>સ્તનના ચેપ, પેટમાં થતો સોજો કે ચેપ : 500 મિગ્રા, દિવસમાં 4 વખત, 10 દિવસ માટે<br/>ત્વચાના ચેપ માટે કે શેંકોઇડ માટે : 500 મિગ્રા 4 વખત, 7 દિવસ માટે<br/>બીજી ઉપયોગ : ગળાનો ચેપ, ન્યુમોનીયા, ટ્રેડોમા, ખીલ</p> |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</p>                           | <p>મેઝોલાઇટ વિભાગની કોઈ પણ દવાની એલર્જ હોય તો આ દવા ન વાપરવી.</p>  |
| <p>આડઅસરો :</p>   | <p>ઉષ્ણ આવવા, ઉલ્લી થવી,<br/>પેટમાં ગરબડ થાય તેવું લાગે, ઝડપ થવા</p>   |
| <p>ઉપયોગી માહિતી :</p>                                        | <p>જમવાના 1 કલાક પહેલાં કે 2 કલાક પછી જે આ દવા લેવામાં આવે તો ધણી સારી અસર થાય છે. જે આ દવાથી પેટમાં ગરબડ જણાય તો દવા થોડા ખોરાક સાથે લેવી. દીકરીઓને તોડવી નહીં - આ દવા પોતાનું કામ શરૂ કરે તે પહેલાં તેના પર પેટમાં રહેલાં જલદ પ્રવાહીની અસર અટકાવવા દીકરીઓ તોડવી ન જોઈએ.</p>                                 |
| <p>બીજી ઉપયોગી દવાઓ :</p>  | <p>સ્તનના ચેપો માટે : એમોકસીલીન, સિફ્લેક્સીન, કલોકસાસીલીન<br/>મૂત્રાશયના ચેપો માટે : એમ્પીસીલીન, કોટ્રાયમોક્સેઝોલ<br/>બાળકની આંખોની સંભાળ માટે : ટેટ્રાસાયક્લીનનો આંખમાં આંજવાનો મલમ</p>   |

## પુસ્તકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી

### ઇસ્ટ્રોજન estrogen



ઇસ્ટ્રોજનના જુદા જુદા રાસાયણિક પ્રકાર ગર્ભનિયંત્રણની ગોળીઓ અને ઇન્જેક્શનમાં વપરાય છે. સીના શરીરમાં લે ઇસ્ટ્રોજન અંતઃસ્વાપ્ને હોય છે, તેના જેવા જ આ રાસાયણિક પ્રકાર પણ હોય છે. ઇસ્ટ્રોજનનો ઉપયોગ અસાધારણ રક્તસ્થાવ કે રન્નેનિવૃત્તિની તકલીફ દૂર કરવામાં પણ થાય છે.

### ઇથામ્બુટોલ ethambutol

(કેમબ્યુટોલ-Cambutol, ઈબ્યુટોલ-Ebutol, ઈટીબી-Etibi, માયમબ્યુટોલ-Myambutol, માયકોસ્ટાટ-Mycostat, થેમિબ્યુટોલ-Themibutol, ટીબિટોલ-Tibitol)

આ દવાનો ઉપયોગ ક્ષય રોગમાં કરવામાં આવે છે, આ દવા બીજી ક્ષયવિરોધી દવાઓ સાથે જ આપવામાં આવે છે.

### દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :



ડીક્ટીઓ : 200 મિ.ગ્રા. 600 મિ.ગ્રા. 1000 મિ.ગ્રા.  
400 મિ.ગ્રા. 800 મિ.ગ્રા.

### ક્યારે અને કેટલી માત્રામાં લેવી :



આ દવાની માત્રા ક્ષયના પ્રકાર અને જે તે ભૌગોલિક સ્થળ પર આધાર રાખે છે. મોટા ભાગે એની માત્રા ફેનિક 15 મિગ્રા, એક કિલોગ્રામના વજન માટે છે. આ દવાની સધળી માત્રા ભેગીજ-એકજ વખત દિવસમાં આપવામાં આવે છે.  
(હંમેશા બીજી ક્ષયવિરોધી દવા સાથે જ આપવી.)

### કોણે આ દવા ન લેવી જોઈએ :



જે લોકોને આંખની દ્રષ્ટિમાં ગંભીર પ્રકારની તકલીફ હોય  
જે લોકોને મૂત્રપિંડની તકલીફ હોય.

### આડઅસરો :




આ દવાથી એક કે બન્ને આંખોમાં દ્રષ્ટિના ફેરફારો થવાની સંભાવના છે.

### ઉપયોગી માહિતી :



ક્ષય માટે દવાઓ પૂરતી માત્રામાં અને પૂરતા સમય માટે લેવી ખૂબ જરૂરી છે. (પૂરતો સમય કદાચ 1 વર્ષ પણ હોઈ શકે) જે દવા વર્ચ્યેથી લેવાની બંધ કરવામાં આવે તો બીજી આસપાસના લોકોને ચેપ લાગવાની શક્યતા છે.

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |   |  |
|---|---|--|
| <p><b>જેન્ટામાઇસીન</b><br/><b>gentamicin</b></p> <p>(બાયોગ્રેસીન-Biogracin, ગેરામાયસીન-Garamycin,<br/>જેન્ટિસીન-Genticyn, મેરિજેન્ટા-Merigenta)</p>   |    |  |
| <p>એમાઇનોગ્લાયકોસાઇડ વિભાગની આ એક બહુ અસરકારક જિવાણુપ્રતિરોધક દવા છે કે જે મૂત્રપિંડના ચેપની સારવારમાં ગોનોરિયા નામના દર્દમાં અને બીજા ગંભીર ચેપોની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. પેઢું પર આવી ગએલા સોન્નમાં પણ આ દવા બીજુ દવાઓ જેઠે વાપરી શકાય. આ દવાનો ઉપયોગ ત્યારે જ થવો જેઠાં જ્યારે દર્દને ઉલ્લીઠી હોય અથવા તો બીજુ જિવાણુપ્રતિરોધક દવાઓ ઉપલબ્ધ ના હોય. આ દવાના બીજા ઉપયોગો આ પ્રમાણે છે : દાકી ગયેલા ભાગને જ્યારે ચેપ લાગી જાય, મૂત્રતંત્રના ચેપો, ફેફસાંનો ચેપ, વરાધ, કાનનો ચેપ, મગજના આવરણનો ચેપ, પેટમાંના પેરિટોનિયમ (આવરણ)નો ચેપ</p> |   |  |
| <p>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</p>  |  <p>ઠંડેકશન - 2 મિલી (10 કે 40 મિગ્રા/મીલી)</p>  |  |
| <p>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>  | <p>ગર્ભપાત પછીના ગંભીર પ્રકારના ચેપોમાં :<br/>આ દવા સ્વીના વજનપ્રમાણે આપવી જેઠાંએ.<br/>દરેક કિલોના 5 મિગ્રા. પ્રમાણે આ દવા ઠંડેકશનના રૂપમાં સ્નાયુમાં આપી હેવી - પણ<br/>આ આખી માત્રા ત્રણ સરખા ભાગમાં વહેંચીને દિવસમાં ત્રણ વાર આપવી (સવારે, બપોરે<br/>અને રાત્રે) અને 5 થી 7 દિવસ સુધી આ દવા આપવી. સરેરાશ માત્રા - પહેલા<br/>80 મિગ્રા-સ્નાયુમાં આપવી પછી 60 મિગ્રા દવા દિવસમાં ત્રણ વાર આપવી.</p> |  |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જેઠાંએ :</p>   |  <p>સુગર્ભા સ્વીઓ<br/>જેમને મૂત્રપિંડની કોઈપણ તકલીફ હોય<br/>જેમને અમાઇનોગ્લાયકોસાઇડ વિભાગની<br/>બીજુ દવાઓ સામે પ્રતિક્રિયા થતી હોય</p>   | <p>ઉપયોગી માહિતી :</p>  <p>આ દવા ગંભીર પ્રકારની આડઅસર<br/>કરે છે અને તેની માત્રા ગળાવામાં<br/>પણ મુશ્કેલીઓ આવી શકે છે તેથી<br/>જ્યારે બીજુ સલામત<br/>જિવાણુપ્રતિરોધક દવાઓ ઉપલબ્ધ<br/>ન હોય ત્યારે જ આ દવા વાપરવી.</p> |
| <p>આડઅસરો :</p>   |  <p>મૂત્રપિંડની તકલીફ<br/>બહેરાપણું</p>  | <p>દવા વધુ પડતી<br/>માત્રામાં લેવાઈ<br/>જય તો :</p>  <p>કાનમાં સીટી વાગવી કે સાંભળવામાં<br/>તકલીફ થવી, મૂત્રપિંડની તકલીફ</p>  |
| <p>ચેતવણી :</p>   |  <p>જે સાંભળવામાં કોઈપણ તકલીફ જણાય<br/>કે કાનમાં સીટીઓ સંભળાય તો બીજુ<br/>જિવાણુ પ્રતિરોધક દવા આપવી.<br/>ખૂબ પ્રમાણમાં પ્રવાહી લેવાનું રાખવું.</p>   |  |
| <p>બીજુ ઉપયોગી<br/>દવાઓ :</p>   | <p>ગંભીર પ્રકારના ચેપ માટે :</p> <p>સેફીકાઇમ, કેનામાયસીન, સેફ્ટ્રાયોક્ઝોન<br/>મૂત્રપિંડના ચેપો માટે :</p> <p>એમોક્સિસીલીન, એમ્પીસીલીન, નોર્ફ્લોક્સાસીન</p>  |  |

## પુષ્ટકમાં સૂચવેલી દવાઓ વિશે માહિતી

### જૈન્શન વાયોલેટ

**Gentian Violet**

આ જંતુમુક્તકરનાર રસાયણત્વચા, મોહું અને યોનિમાર્ગના ચેપમાં વપરાય છે.

દવાનાં ઉપલબ્ધ

સ્વરૂપો :



1% દ્રાવણ

ક્ષારે અને કેટલી

માત્રામાં લેવી :



યોનિમાર્ગના ચેપો માટે : 1% દ્રાવણમાં ચોપખા રનું પૂમડું કુખાડવું, તે પૂમડું

યોનિમાર્ગમાં અંદર ઉપરના ભાગે મૂકવું, આ પૂમડું આખી રાત મૂકી રાખવું -

એવું ત્રણ રાત માટે કરવું. સવરે પૂમડું કાઢવાનું ભૂલવું નહીં.

મોઢામાં થતી ફૂગ માટે : 1% દ્રાવણના કોગળા કરવા - 1 કોગળા મિનીટ માટે કરવા

અને રોજ બે વખત કરવા.

ત્વચામાં થતા ચેપ માટે : સૌથી પહેલાં ચેપ થએલો હોય તે ભાગ સાબુ અને પાણીથી

બરાબર સ્વચ્છ કરવો અને પછી તેને સૂક્ખવા દેવો. તેના પછી આ દ્રાવણ ત્યાં લગાડવું.

આ પ્રમાણે રોજ દિવસના ત્રણ વાર કરવું અને 5 દિવસ સુધી આ કિયા કરવી.

આડઅસરો :



ચામડીનો ચચરાટ

જે ભાગ પર આ દવા લગાડી હોય તે ભાગ જમલી રંગનો થઈ જય.

ચેતવણી :



યોનિમાર્ગમાં ઉપયોગ કરતા હોય તો તેટલા દિવસ સંબોગ ટાળો.

જ્યારે એના ઉપયોગથી ચામડીમાં ચચરાટ થાય ત્યારે તેનો ઉપયોગ

ન કરવો.

ઉપયોગી માહિતી :



બાળકના મોંમાં આ દવા લગાડ્યા પછી, બાળકને ઉંઘે માથે સૂવડાવી

દેવું જેથી આ દવા મોંથી હજમ ના થઈ જય.

આ દવાથી શરીર કે કપડામાં જંબતી રંગ બેસી જય છે.

બીજુ ઉપયોગી

દવાઓ :

ત્વચાના ચેપ માટે : જિવાણુરોધક મલમ, આયોડીન

મોંમાની છારી માટે : લીંબુ (નાના બાળકો માટે નહીં) કે નિસ્ટેટીન

યોનિમાર્ગના ફૂગથી થતા ચેપો માટે : નિસ્ટેટીન, માઇકોનેઝોલ, કલોટ્રાયમેઝોલ

## પુસ્તકમાં ખૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |                                 |   |   |                           |  |  |
|--|---------------------------------|---|---|---------------------------|--|--|
| <b>હીપેટાઈટીસ-બી વેક્સીન</b> (બીવેક-Bevac, બાયોવેક-બી-Biovac-B, એન્જરીક્સ-બી-Engerix-B, જેનવેક-બી-Genevac-B, એચ્બીવેક-Hbvac, રીવેક-બી-Revac-B)   |                                 |   |   |                           |  |  |
| આ રસી યકૃતના વિષાળુ-બી થી થતા ચેપ-રોગ (પ્રકાર બી) સામે રક્ષણ આપે છે.   |                                 |   |   |                           |  |  |
| દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો:   |                                 | 0.5 મિલી લિંગ<br>1.0 મિલી   | 5.0 મિલી<br>10.0 મિલી                     | બધામાં 20 માઇકોગ્રામ/મિલી |  |  |
| <b>ક્યારે અને કેટલી માત્રામાં લેવી:</b> <p>આ રસી હંમેશા હાથના ઉપરના ભાગમાં કે થાપામાં આપવામાં આવે છે.<br/>કુલ માત્રા ત્રણ વખત ઈલેક્શન આપીને પૂરી કરાય છે.<br/>1 લી વાર આપ્યા પછી લગભગ 1-2 મહિનાના અંતરે બીજીવાર આપવામાં આવે છે.<br/>અને ત્યાર પછી છેલ્લી વાર લગભગ 4-12 મહિના પછી આપવામાં આવે છે.</p> |                                 |   |   |                           |  |  |
| માત્રા (કઈ કંપનીની બનાવેલ રસી લો છો તેની પર આધાર રાખે છે)  |                                 |   |   |                           |  |  |
| પુષ્ટ વયના માટે  | એન્જેરીક્સ બી                   | 20 માઇકોગ્રામ   | રીકોમ્બીવેક્સ એચ્બી                       | 10 માઇકોગ્રામ             |  |  |
| બાળકો માટે   |                                 |   |   |                           |  |  |
| 0 થી 11 વર્ષ સુધી  | 10 માઇકોગ્રામ                   | 2.5 માઇકોગ્રામ  |   |                           |  |  |
| 11-19 વર્ષ   | 20 માઇકોગ્રામ                   | 5 માઇકોગ્રામ  |   |                           |  |  |
| આડઅસરો:  |                                 | કોઈક જ વાર :  | માથામાં દુઃખાવો, નબળાઈ,<br>તાવ, થાકી જવું |                           |  |  |
| ઉપયોગી માહિતી:   |                                 | આ રસીને 2 થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં રાખવી જેઠાં નહીંતો<br>તેની ક્ષમતામાં ઘટાડો થઈ જય છે.<br>આ રસીને હંમેશાં હાથના ઉપરના ભાગમાં અથવા તો થાપામાં<br>ઈલેક્શન દ્વારા અપાય છે. |   |                           |  |  |
| બીજી ઉપયોગી દવાઓ:  | હીપેટાઈટીસ-બી ઈભ્યુન ગલોઝ્યુલિન |   |   |                           |  |  |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |   |   |
|---|---|---|
| <b>હાઇડ્રોકોર્ટિસોન (કોર્ટીસોલ)</b><br><b>hydrocortisone or cortisol</b>  | (કોર્ટેન્સ-Corts, એફકોર્લિન-Efcorlin,<br>હાયકોસન-Hycoson, હાઇડ્રોકોર્ટિસોન સોડિયમ સ્ક્રીનેટ-<br>Hydrocortisone Sodium Succinate, પ્રાઈમકોર્ટ-Primcort)  | <b>ચેતવણી</b><br><br> |
| <p>આ મલમથી સોન્ને આવેલો ઓછો થઈ જથું તે મજા જે ખંજવાળ આવતી હોય તો તે પણ ઓછી થઈ જથું છે. આનો ઉપયોગ હરસ (પાઈલ્સ) માં પણ કરી શકાય. આ દવાનું ઈન્જેક્શનનું સ્વરૂપ એલર્જીથી અને લાશીથી શક્કાય.</p> |   |   |
| <b>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :</b>  |    | ફીમ/મલમ 1%, આંખના ટીપાં, નાકના ટીપાં, કાનના ટીપાં<br>ટીકીડીઓ 20 મિગ્રા, ઈન્જેક્શન 100, 200 અને 400 મિગ્રા   |
| <b>ક્યારે અને કેટલી માત્રામાં લેવી :</b><br>  | <p>હરસ, ખંજવાળ અને ચામડી પર ચાઠાં ઉપસી આવે ત્યારે - મલમ - દિવસમાં ત્રણથી ચાર વાર લગાવવો.</p> <p>એલર્જી થી આવેલા shock માટે :</p> <p>500 મિગ્રા સ્નાયુમાં આપવું ચાર કલાક પછી - ૪૩૨ જણાય તો ફરી આપવું.<br/>         જે એલર્જીના લક્ષણો થોડી વાર પછી આવે તો મૌખી 500 મિગ્રા કે 1000 મિગ્રા લઈ લેવું<br/>         (અને ૪૩૨ જણાય તો ફરી પણ આપી શકાય)</p> |   |
| <b>આડઅસરો :</b><br>  | <p>જે મલમ ૧૦ દિવસથી વધારે દિવસ માટે લગાવવામાં આવે તો ચામડી પાતળી થઈ જથું.</p>   |   |
| <b>ચેતવણી :</b><br>  | <p>મલમ લગાડેલો હોય તો તે ભાગ પાટાથી ઢાંકી ન દેવો.</p> <p>સગર્ભા અને ઘાત્રી માતાઓ ટીકીડીઓ લેવામાં જરા વિચાર કરે પણ મલમ ઉપયોગમાં લઈ શકાય છે.</p>  |   |
| <b>ઉપયોગી માહિતી :</b><br>   | <p>લોહીનું ઉંચું દબાણ<br/>         પેશાબ વધારે થવો</p>  |   |
| <b>બીજી ઉપયોગી દવાઓ :</b>   | <p>એલર્જીથી થતા શોક માટે - ડેક્સામીથેસોન<br/>         એલર્જી કે ખંજવાળ માટે - ડાયફ્રિનહાય્ડ્રેમાઈન</p>  |   |
| <b>અન્ય ઉપયોગો :</b>  | <p>સતત દમ રહેવો. (સ્ટેટ્સ અસ્થમેટીક્સ)</p> <p>મગજના આવરણનો ટી.બી.</p>   |   |

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |  |   |
|---|--|---|
| <b>હાઇડ્રોક્સીઝિન.</b><br><b>hydroxyzine</b>  | (એટેરેક્સ-Atarax)<br> | <b>ચેતવણી</b>   |
| <p>આ દવા, શરીરમાં થતા હીસ્ટામ્ફીન નામના પદાર્થની અસર થવા દેતી નથી અને તેનો ઉપયોગ એલજીથી થતી ખંજવાળને કાબુમાં લાવવાનું છે. કોઈવાર આ દવા એલજીથી થતા ઉભા, ઉલ્ટી અને ચિંતાને પણ દૂર કરે છે.</p> |  |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>  |                         | ઈકડીઓ 10 મિગ્રા અને 25 મિગ્રા.<br>પ્રવાહી 100 મિલી (10 મિગ્રા/5 મિલી)<br>ઇન્જેક્શન 2 મિલી (25 મિગ્રા/1 મિલી)  |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>  |                         | ખંજવાળ માટે 25 થી 50 મિગ્રા - ઈકડી સ્વરૂપે - દિવસમાં ત્રણ કે ચાર વાર<br>ચિંતા ઓછી કરવા 25 થી 50 મિગ્રા - ઈકડીઓના સ્વરૂપે દિવસમાં 4 વાર<br><b>એલજી શૉડ્ક માટે :</b><br>25 મિગ્રા ઇન્જેક્શન - સ્નાયુમાં બાળકો માટે<br>50 મિગ્રા ઇન્જેક્શન - સ્નાયુમાં વયસ્ક લોકો માટે |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>   |                       | સગભર્વિવસ્થાના પહેલા ત્રણ મહીના।<br>(બાકીની સગભર્વિવસ્થામાં અને સ્તનપાન કરાવતી વખતે આ દવા ત્યારેજ વાપરવી કે જ્યારે બીજુ કોઈ દવાનો વિકલ્પ ન હોય.)<br>સતર્ક રહેવું હોય તો આ દવા ન વાપરવી.   |
| <b>આડઅસરો :</b>   |                       | મોં સૂકાઈ જવું, ઉંઘ આવવી, ભૂખ મરી જવી વગેરે   |
| <b>દવા વધુ પડતી<br/>માત્રામાં લેવાઈ<br/>જય તો :</b>   |                       | ઉંઘ આવવી  |
| <b>બીજુ ઉપયોગી દવાઓ :</b>   |  | ખંજવાળ કે એલજી માટે : ડાઇફ્રોનાફ્રોમાઇન, પ્રોમિથાઝિન<br>ચિંતા માટે : ડાય્ઝેયામ  |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |   |
|--|---|
| <b>આઇબુપ્રોફેન<br/>ibuprofen</b><br><small>(બ્રેન-Bren, બ્રુફેન-Brufen, ઇબુગેસિક-Ibugesic, ઇબુસિન્થ-Ibusynth, નોર્સ્વેસ-Norswes)</small>   |    |
| <p>કોઈપણ જગ્યાનો દુઃખાવો, કોઈપણ જલનો સોજેકે તાવમાં આ દવા વાપરી શકાય. માસિક વખતે થતાદુઃખાવાને બેચેની દૂર કરવા માટે તેમજ “વા” ને લીધે થતા હર્દ માટે પણ આ દવાનો ઉપયોગ કરી શકાય.</p> |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>   |  <p>ડીકડીઓ : 200 મિ.ગ્રા. 600 મિ.ગ્રા.<br/>400 મિ.ગ્રા. 800 મિ.ગ્રા.<br/>પ્રવાહી : 60 મિલિ (125 મિગ્રા/5 મિલિ)</p> |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>   |  <p>200 થી 400 મિગ્રા, દિવસમાં 4 થી 6 વખત લઈ શકાય.<br/>(દિવસ દરમિયાન માત્રા 2400 મિગ્રાથી વધવી ના જોઈએ)</p>        |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>  |  <p>પેટમાં ચાંદા હોય તો ન લેવી<br/>સગર્ભાવસ્થામાં છેલ્લા 3 મહિના દરમિયાન</p>                                      |
| <b>આડઅસરો :</b>  |  <p>પેટમાં બળતરા<br/>પેટમાં દુઃખાવો</p>  |
| <b>ચેતવણી :</b>  |  <p>શાખાકિયા કરાવી હોય તો અઠવાડિયા સુધી આ દવા ન લેવી જોઈએ.</p>   |
| <b>ઉપયોગી માહિતી :</b>   |  <p>જે ખાવાના સાથે લીધી હોય તો ઉત્તમ પરિણામ આવે છે.<br/>(ખાવાનું જે ડેરીની કોઈપણ પેદાશ હોય તો વધુ સારું)</p>     |
| <b>બીજી ઉપયોગી દવાઓ :</b>  | <p>દુઃખાવા, સોજેકે તાવ માટે : એસ્પીરીન<br/>દુઃખાવા અને તાવ માટે : એસીટામીનોફેન<br/>સખત દુઃખાવા માટે : કોડીન, મોર્ફિન</p>  |

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

**આઈસોનીઆર્ડ** (આઈસોનેક્સ-Isonex, સોલોનેક્સ-Solonex)  
isoniazid

ક્ષયરોગની સારવારમાં આ દવા બહુ ઉપયોગી છે. (ક્ષયરોગની સારવારમાં આ દવા બીજી ક્ષયવિરોધી દવાઓ સાથે લેવાની હોય છે.)

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



દીકરીઓ : 100 મિગ્રા અને 300 મિગ્રા  
પ્રવાહી : 50 મિગ્રા/5 મિલી

ક્ષયારે અને કેટલી  
માત્રામાં લેવી :



ક્ષયવિરોધી બધી દવાઓની માત્રા જુદી જુદી પદ્ધતિઓમાં જુદી જુદી છે.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



ઘૃત-લીવર-પરનો સોને  
લીવરની કોઈપણ તકલીફ/રોગ  
પહેલા આ દવા લીધી હોય અને લીવરમાં તકલીફ થતા બંધ કરવી પડી હોય.

આડઅસરો :



હાથ અને પગમાં ઝણઝણાઈ થાય કે પછી દુઃખાવો થાય.  
લીવરનો સોને (કે જેના લક્ષણો છે થાકી જવું, ભૂખ ન લાગવી, ઉષ્ણા, ઉલ્ટી,  
ઘેરા રંગનો પેશાબ થલો અથવા તો આંખની કિંદી પીળાશ પડતી થવી) આવું જે થાય  
તો તરત દવાનો ઉપયોગ બંધ કરી દેવો.

ઉપયોગી માહિતી :



દિવસમાં 300 મિગ્રાથી વધુ માત્રામાં દવા ન લેવી.  
ક્ષય માટે દવાનો આખો કોર્સ પૂરો કરવો કે જેથી કરીને બીજાનોને  
ચેપ ન લાગે.

દવા વધુ પડતી  
માત્રામાં લેવાઈ  
જય તો :



ઉષ્ણા, ઉલ્ટી, બોતવામાં તોતડાવું, ચક્કર જેવું લાગવું,  
સ્પષ્ટ જેવામાં તકલીફ  
જે વધારે માત્રામાં દવા લેવાની હોય તો  
1 ગ્રામ પાયરીડોક્સીન રોજ લેવું.



## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

**કેનામાયસીન**  
kanamycin

(કેનોમેક-Kannamac, કેનાસીન-Kanacin)



અમાઈનો ગલાઇકોસાઇડ્સ વિભાગની આ એક અગત્યની જીવાણુનાશક દવા છે. આ દવા ઘણા ગંભીર પ્રકારના ચેપોની સારવારમાં તેમજ ગોનોરિયાની સારવારમાં વપરાય છે. અન્ય વધારે સલામત જીવાણુનાશક દવાઓ ઉપલબ્ધ ના હોય ત્યારે જ આ દવા વાપરવી.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઠિન્જેક્શન : 500 મિગ્રા, 750 મિગ્રા, 1000 મિગ્રા

ક્યારે અને કેટલી

ગંભીર પ્રકારના ચેપો માટે : સ્વીના વજન પ્રમાણે દવાની માત્રા નક્કી કરવી.

માત્રામાં લેવી :

15 મિગ્રા પ્રતિ કિલો પ્રમાણે કુલ માત્રા થાય અને સરખા બે ભાગમાં વહેંચીને દ્વેક

સ્વરૂપો :

ભાગ દિવસમાં બે વાર 5 થી 7 દિવસ સુધી ઠિન્જેક્શન આપવા અથવા

500 મિગ્રા ઠિન્જેક્શન (સનાયુમાં) દિવસમાં બે વાર - 5 થી 7 દિવસ સુધી

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



સગર્ભાસ્ક્લીઓ, મૂત્રાશયની બીમારીવાળા લોકો, જે અમાઈનો ગલાઇકોસાઇડ્સ વિભાગની બીજી દવાઓની એલજ હોય તો

આડઅસરો :



મૂત્રાશયની તકલીફ  
બહેરાશ

ચેતવણી :



જે સાંભળવામાં તકલીફ થતી  
હોય કે પછી કાનમાં કોઈ વિચિત્ર  
અવાજ સંભળાતો હોય તો આ  
દવા બંધ કરી બીજી કોઈ દવા  
લેવી, ખૂબ પ્રવાહી પીવું

દવા વધુ પડતી

માત્રામાં લેવાઈ  
જય તો :



કાનમાં વિચિત્ર અવાજે  
સંભળવા કે સાંભળવામાં  
મુશ્કેલી પડવી,  
મૂત્રની તકલીફો

ઉપયોગી માહિતી :



ગંભીર આડઅસરો અને દવાની  
માત્રા ગણવાની મુશ્કેલી ના કારણે  
અન્ય વધુ સલામત  
જીવાણુનાશક દવાઓ ઉપલબ્ધ  
ના હોય તો જ આ દવાનો ઉપયોગ  
કરવો જોઈએ.

બીજી ઉપયોગી દવાઓ :

ગંભીર પ્રકારના ચેપો કે ગોનોરિયા માટે :  
સેફીકાઈમ, સેફ્રોયોક્ઝોન, નોરફ્લોક્સાસીન

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |  |
|--|--|
| <p><b>કિટોકોનેઝોલ.</b><br/><b>ketoconazole</b></p> <p>(ફંગિસાઇડ-૨૦૦-Fungicide-200, કેનાજોલ-Kenazol,<br/>નીજરાલ-Nizral)</p>   | <p><b>ચેતવણી</b></p>    |
| <p>કુગથી થતા ચેપો (જેવા કે મૌંઢામાંની છારી) ની સારવારમાં આ દવા વપરાય છે. જે દર્દીને એઈડસ હોય તો જ આ દવાનો ઉપયોગ થાય છે. આ દવા ખૂબ મૌંઢી છે અને કોઈવાર તેને મેળવવામાં પણ મુશ્કેલી પડે છે.</p> |  |
| <p><b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b></p>   | <p>દીકરીઓ 200 મિગ્રા.<br/>ત્વચા પર લગાવવાનો મલમ<br/>વાળનો શેખ્પૂ - 2%</p>  |
| <p><b>કયારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b></p>    | <p>કુગથી થતા ચેપ માટે :<br/>દિવસમાં 200 મિગ્રા - એકસાથે લઈ લેવી. સારવાર 10 દિવસ ચાલુ રાખવી.<br/>છારી (મૌંની અંદરનો ફૂગનો ચેપ)<br/>200 મિગ્રા દિવસમાં બે વાર - 14 દિવસ માટે</p> |
| <p><b>આડઅસરો :</b></p>    | <p>ઉંડકા<br/>ઉલ્ટી</p>   |
| <p><b>ચેતવણી :</b></p>    | <p>સગર્ભાવસ્થા, સ્તનપાન કરાવતી મહિલાઓ, મલમ કે શેખ્પૂને યોનિમાર્ગમાં ન મૂકવો, ભૂખ્યાપેટે ન લેવી, જે દાડ સાથે લેવામાં આવે તો hot flashes થવાની સંભાવના છે.</p>                   |
| <p><b>ઉપયોગી માહિતી :</b></p>   | <p>નારંગી કે મોસંબીના રસ સાથે લેવામાં આવે તો ઘણી સારી અસર કરે છે.</p>  |
| <p><b>બીજુ ઉપયોગી દવાઓ :</b></p>   | <p>જે ફૂગનો ચેપ હોય અને સંભોગથી થતા ચેપનો હોય તો<br/>નિસ્ટેટીન, કલોટ્રાયમેઝોલ</p>  |



મેનેશિયમ સલ્ફેટ

**magnesium sulfate**

જે સગર્ભા સ્ત્રીને લોહીનું ઉચ્ચ દબાણ રહેતું હોય, પરે સોજ આવી ગયા હોય અને તેને તાણ પણ આવવા લાગે તો તેને માટે મેનેશિયમ સલ્ફેટ એક ખૂબ સારી દવા છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઇન્જેક્શન : 10%, 12.5%, 25%, 50%

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



તાણ માટે : 10 ગ્રામનું ઇન્જેક્શન સનાયુમાં

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



જે મહિલાને મૂત્રપિંડની બિમારી હોય તો

ચેતવણી :



આ દવાનો ઉપયોગ ત્યારે જ કરવો જ્યારે લોહીનું દબાણ 160/110 કરતાં વધારે હોય

આ દવા આપી દીધા પછી, મહિલાનું લોહીનું દબાણ થોડી-થોડી વારે માપતા રહેલું.

આ દવા જે વધારે અપાઈ જય તો મહિલાનો શ્વાસોચ્છવાસ બંધ થઈ શકે છે.

ઉપયોગી માહિતી :



વધારે માત્રાનું ઇન્જેક્શન આપવાનું હોય ત્યારે જરી સોયનો ઉપયોગ કરવો પડે છે કે જે કષ્ટદાયક નીવડી શકે એટલા માટે કુલ માત્રાના બે ભાગ પાડી દરેક ભાગ એક થાપામાં આપી દેવો.

દવા વધુ પડતી  
માત્રામાં લેવાઈ  
જય તો :



પરસેબો થવો, નબળાઈ, લોહીનું દબાણ ઘટી જવું,  
શ્વાસ લેવામાં તકલીફ

બીજુ ઉપયોગી દવાઓ : તાણ માટે : ડાયઝેપામ

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |  |
|--|--|
| <p><b>મિડ્રોક્સીપ્રોજેસ્ટીરોન એસીટે</b><br/><b>medroxyprogesterone acetate</b></p> <p>(ડીવારી-Deviry, ડબ-Dub, મોડ્સ-Modus,<br/>ઓર્ગેમિડ-Orgamed, પ્રોવેરા-Provera)</p>   | <p><b>ચેતવણી</b></p>    |
| <p>શરીરમાં કુદરતી રીતે પેઢા થતા અંત:ખાવ-પ્રોજેસ્ટીરોનનું આ એ રાસાયણિક સ્વરૂપ છે. અંત:ખાવના સ્તરમાં થતા ફેરફરની લીધે ઘણીવાર માસિક અનિયમિત થઈ જય છે. (આ મોટા ભાગે રન્નેનિવૃત્તિના સમયે જેવા ભણે છે) અને તે વખતે આ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. કુંભ નિયોજન માટેના ઉપયોગ માટે જુઓ પ્રકરણ- ૧૨</p> |  |
| <p>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</p>    | <p>દીકરીઓ : 2.5 મિગ્રા, 5 મિગ્રા અને 10 મિગ્રા</p>   |
| <p>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>    | <p>બહુ વધારે પ્રમાણમાં માસિક આવતું હોય ત્યારે 10 મિગ્રા,<br/>દિવસમાં એક વાર - દસ દિવસ માટે (જો તો પણ રક્તખાવ બંધ ના<br/>થાય તો વધુ 10 દિવસ દવા લેવી)</p> |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</p>   | <p>યકૃત (લીવર) ના ચેપવાળી સ્વીઓ<br/>સ્તરનાં કેન્સર<br/>યોનિમાર્ગના મુખનાં કેન્સર</p>   |
| <p>આડઅસરો :</p>   | <p>ઉંફા<br/>થાકી જવું<br/>માથાનો દુઃખાવો</p>   |
| <p>ચેતવણી :</p>   | <p>જે 20 દિવસની સારવાર પછી પણ રક્તખાવ ચાલુ રહે તો<br/>આરોગ્ય કાર્યકરને જણ કરવી.</p>  |




**મિથાઇલ અર્ગોનોવિન**  
methyl ergonovine

સુવાવડ પછી થતા વધુ પડતા રક્ત સ્વાવની સારવારમાં આ દવા વપરાય છે; તે ગર્ભાશય તેમજ રક્તવાહિનીઓના સનાયુઓનું સંકોચન કરી રક્તસ્વાબ અટકાવે છે. આ દવા અર્ગોમેટ્રીન કે અર્ગોનોવિન જેવી છે.

**માઇકોનેઝોલ**  
miconazole

(ગાયનો-ડાક્ટરીન-Gyno-Daktarin, કેન્ડિસ્ટેટ-Candistat, કેન્ડિઝોલ-Candidzole, ડાક્ટરીન-Daktrin, માયકોજેલ-Micogel, ઝોલ-Zole)



યોનિમાર્ગમાં થતા ફૂગના ચેપોની સારવારમાં આ દવા વપરાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



જેલ (યોનિમાર્ગમાં લગાડવા માટે) - 2%  
કીમ - 2%, યોનિમાર્ગમાં મૂકવાની ટીકડી 100 મિગ્રા, 200 મિગ્રા  
મલમ (ચામડી માટેનો) / લોશન / પાઉડર - 2%  
આંખમાં આંજવા applicaps - 1% (w/v)

ક્ષારે અને કેટલી  
માત્રામાં લેવી :



ફૂગથી થતા ચેપ માટે :

કીમ : 5 ગ્રામ કીમ યોનિમાર્ગમાં રોજ રાત્રે સાત દિવસ સુધી મૂકવું.  
100 mgm ની ટીકડી સાત દિવસ માટે રોજ રાત્રે મૂકવી.  
200 mgm ની ટીકડી ત્રણ દિવસ માટે રોજ રાત્રે મૂકવી.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



સગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહીના

આડઅસરો :



ચચરાટ કે બળતરા થાય.

ચેતવણી :



જે માઇકોનેમોલથી ચચરાટ થાય, તો તેનો વપરાશ બંધ કરી દેવો.  
ત્રણ-ચાર દિવસ સુધી સમાગમ ટાળવો, જેથી કરીને તમારા સાથીને  
ચેપ ના લાગે.  
આંખથી દૂર રાખવું

બીજુ ઉપયોગી દવાઓ :

નીસ્ટેટીન, કલોટ્રાથમેઝોલ, જેન્શન વાયોલેટ (જમલી દવા), કિટોકોનેઝોલ

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|  |   |
|--|---|
| <p><b>મેટ્રોનિડોલ</b><br/>metronidazole</p> <p>(એરિસ્ટોફ્લગ-Aristogyl, ફ્લેગ્લ-Flagyl, મેટ્રોફ્લગ-Metrogyl,<br/>કોમ્પેબા-Compeba)</p>                | <p>ચેતવણી</p>    |
| <p>યોનિમાર્ગમાં ટ્રાયકોમોનાસ કે ફૂગને લીધે થતા ચેપમાં આ દવા વપરાય છે. કોઈ જીવાણુજન્ય ચેપ કે અમીબીક જતના મરદામાં પણ આ દવા ખૂબ સારા પરિણામ આપે છે.</p> |   |
| <p>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</p>                                  | <p>ટીકડીઓ : 200 મીગ્રા અને 400 મીગ્રા.<br/>પ્રવાહી : 200 મીગ્રા/5 મિલીમાં<br/>ઠંડેકશન : 100 મીલી (5 મીગ્રા/1 મિલીમાં)<br/>યોનિમાર્ગમાં મૂકવા માટે જેલ 30 ગ્રામ (10 મી.ગ્રામ/ગ્રામ)</p>  |
| <p>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</p>                        | <p>સુવાખડ પણી થતા ચેપની સારવારમાં અથવાતો પેટુ પર થતા સોજીમાં 500 મીગ્રા. દિવસમાં બે વાર - દસ દિવસ માટે (બીજી દવાઓ સાથે)<br/>યોનિમાર્ગના સાધારણ ચેપ માટે :<br/>દિવસમાં બે વાર યોનિમાર્ગમાં જેલ મૂકવી.<br/>યોનિમાર્ગના ચેપ માટે : (ટ્રાયકોમોનાસ, ફૂગ કે બીજા જીવાણુઓ)<br/>જે દર્દી સગર્ભા ના હોય તો 2 ગ્રામની ટીકડીઓ એકજ વાર લેવી. સગર્ભાવસ્થામાં 400 મીગ્રાની ટીકડીઓ દિવસમાં બે વાર લેવી અને દવા 7 દિવસ સુધી લેવી.<br/>ગર્ભપાત પછીના ગંભીર પ્રકારના ચેપ માટે :<br/>400 મીગ્રા (મોઢા વાટે) દિવસમાં ચાર વાર અથવા દિવસમાં બે વાર 1 ગ્રામનું ઠંડેકશન શિરામાં આપવું. લોહી સાથે જાડા થાય ત્યારે (તાવ હોય કે ના હોય) 400 મીગ્રા,<br/>દિવસમાં ત્રણ વાર, 7 દિવસ માટે<br/>અમીબિઅસીસ - દિવસમાં કુલ 35 થી 50 મીગ્રા દર 1 કિલો વજન ફીઠ. કુલ માત્રાના ત્રણ સરખા ભાગ કરી દિવસમાં ત્રણ વાર લેવું 5 થી 7 દિવસ સુધી સારવાર ચાલુ રાખવી.<br/>(એટલે કે 400 થી 800 મીગ્રા, દિવસમાં ત્રણવાર 5 થી 7 દિવસ સુધી)</p> |
| <p>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</p>                               | <p>જેને યકૃત (લીવર)ની કોઈપણ જતની<br/>તકલીફ હોય તે</p>   |
| <p>આડઅસરો :</p>   | <p>મૌંમા ધાતુનો સ્વાદ આવવો, ઘેરા રંગનો<br/>પેશાબ થવો, પેટમાં ગરખબ થવી, ઉંબા,<br/>માથાનો દુઃખાવો</p>   |
| <p>ચેતવણી :</p>   | <p>જે શરીરનો કોઈ પણ ભાગ જૂછો પડી ગયેલો લાગે<br/>તો દવા લેવાની બંધ કરવી.<br/>જે સગર્ભાવસ્થાના પહેલા ત્રણ મહીના હોય તો બની<br/>શકે ત્યાં સુધી આ દવા ન લેવી. જે લેવી ન પડે એમ<br/>હોય તો મૌંમા માત્રામાં દવા ન લેવી.<br/>ધાર્તી માતાઓ માટે મૌંમા માત્રામાં દવા લેવી સલામત છે.</p>  |
|  | <p>ઉપયોગી માહિતી :</p>  <p>ક્રી અને પુરુષ, બન્નેની સારવાર કરવી<br/>જોઈએ.<br/>આ દવા લેતી વખતે મધ્યપાન કરવું નહીં.<br/>તેનાથી સખત ઉંબા આવવાની તકલીફ<br/>થઈ શકે છે.</p> <p>બીજી ઉપયોગી દવાઓ :</p> <p>ફૂગ અને ટ્રાયકોમોનાસ માટે :<br/>દીનીઠાજોલ<br/>એઈડસના દર્દીમાં જાડા અટકાવવા<br/>કોટ્રાયમોક્ઝેઝોલ અથવા નોરેફલોકસાસીન</p>   |

## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### મીફેપ્રિસ્ટોન mifepristone

(મીફેગેટ-Mifeget)

આ દવા જયારે મીસોપ્રેસ્ટોલ સાથે વપરાય ત્યારે તે ગર્ભપાત માટે વાપરી શકાય. આ દવા ફક્ત કોઈ ખાસ કાર્યક્રમ ચાલુ હોય તો જ ઉપલબ્ધ છે અને તે ઉપરાંત તે મોટા દવાખાનામાં પણ ઉપલબ્ધ છે. જ્યાં મહિલાઓને એના ઉપયોગ પછી નિરીક્ષણ હેઠળ રાખી શકાય. જેથી કોઈ અધિત ઘટના બને તો તેની સારવાર આપી શકાય.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ટીકડીઓ 200 મિગ્રા  
(ત્રણ ટીકડીઓનું પેકેટ)

કયારે અને કેટલી  
માત્રામાં લેવી :



ગર્ભપાત માટે : 2 મહિનાની સગર્ભવસ્થા થાય તે પહેલા 600 મિગ્રા  
ટીકડીઓ એક વાર મોં વાટે આપવાની. તેના 48 કલાક પછી,  
બીજી દવા જેવી કે મીસોપ્રેસ્ટોલ, 400 માઇકોગ્રામ યોનિમાર્ગમાં  
ઉંચે મૂકવામાં આવે છે.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



જેમને છેલ્લું માસિક આવ્યે 9 અઠવાડિયા થઈ ગયા હોય.

આડઅસર :



પેટમાં ચૂંક આવવી, ઉષ્કા, ઝાડા, પેટમાં દુઃખાવો થવો, ઉલ્ટી,  
યોનિમાર્ગ વાટે રક્તસ્વાવ થવો.

ઉપયોગી માહિતી :



બીજી દવા આપ્યાના 48 કલાક દરમિયાન પેટમાં ચૂંક સાથે અને  
યોનિમાર્ગથી રક્તસ્વાવ સાથે ગર્ભપાત મોટાભાગે થઈ જય છે.

બીજી ઉપયોગી દવાઓ : મીસોપ્રોસ્ટોલ



## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <p><b>મીસોપ્રોસ્ટોલ</b> (મીસોપ્રોસ્ટ-Misoprost)</p> <p><b>misoprostol</b></p> <p>હોજરી (પેટ)માં થતા ચાંદા માટે આ દવા વપરાય છે. તેનો ઉપયોગ ગર્ભપાત કરવામાં પણ થાય છે કારણકે તેનાથી ગર્ભશાયના સનાયુઓનું સંકોચન થાય છે.</p>  |  |
| <p>દવાનાં ઉપલબ્ધ સ્વરૂપો :</p>   | <p>દીકરીઓ : 100 માઇકોગ્રામ, 200 માઇકોગ્રામ</p>   |
| <p>કયારે અને કેટલી માત્રામાં લેવી :</p>    | <p>ગર્ભપાત માટે : 400 માઇકોગ્રામની એક દીકરી યોનિમાર્ગમાં મૂકવી. જે 12 કલાકમાં રક્તસ્વાવ શરૂ ના થાય તો ફરીથી મૂકવી. ફરી પણ જે 12 કલાકમાં રક્તસ્વાવ ના થાય તો બે અઠવાડિયા પછી ફરી પ્રયત્ન કરવો. હોજરીના ચાંદા માટે : 400 થી 800 માઇકોગ્રામ દિવસ દરમિયાન લેવી. આ માત્રા 2 થી 4 વખત ભાગ કરીને લેવી અને સારવાર 4-8 અઠવાડિયા ચાલુ રાખવી.</p> |
| <p>કોણે આ દવા ન લેવી જોઈએ :</p>    | <p>ગર્ભાવસ્થાના ત્રણ મહીના પછી આ દવાનો ઉપયોગ ન કરવો નહીં તો ગર્ભશાય ફાટી જય.</p>   |
| <p>આડઅસરો :</p>  <p>ઉભકા, ઉલ્લી, ઝાડા, માથાનો દુઃખાવો જે સ્તનપાન ચાલુ હોય તો બાળકને ઝાડા થવાનો સંભવ છે.</p>  | <p>દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જય તો :</p>  <p>પેટમાં સખત દુઃખાવો થવો અને યોનિમાર્ગ દ્વારા પુષ્ય રક્તસ્વાવ થવો. (તરત તબીબના સલાહ લેવી જોઈએ)</p>   |
| <p>ચેતવણી :</p>  <p>400 માઇકોગ્રામથી વધારે માત્રા એક વખત સામટી ન મૂકવી અથવા તો દર 12 કલાકે મૂકી શકાય. કારણકે વધુ મૂકવાથી ગર્ભશાય ફાટી જઈ શકે.</p>  | <p>બીજુ ઉપયોગી દવાઓ :</p> <p>ભારતમાં ઈજેક્શન કાર્બોપ્રોસ્ટ (Carboprost) અને ડાયનો પ્રોસ્ટોન-Dinoprostone (PGE-2, જેલ કે યોનિમાં મૂકવાની દીકરી) તબીબી ગર્ભપાત માટે, પ્રસૂતિ કરાવવા, પ્રસૂતિબાદના રક્તસ્વાવ માટે વપરાય છે.</p>   |
| <p>ઉપયોગી માહિતી :</p> <p>મીસોપ્રોસ્ટોલથી પૂર્ણ ગર્ભપાત થવામાં કેટલાક કલાકથી માંડીને કેટલાક દિવસો વીતી જય છે. મોટા ભાગે પૂર્ણ ગર્ભપાત થતો જ નથી. દવા લીધા પછી રક્તસ્વાવ શરૂ થયા પછી ડૉક્ટરની દેખરેખ મેળવવી આવશ્યક છે. જેથી પૂર્ણ ગર્ભપાત કરવામાં યોગ્ય મદદ મળે.</p>  |  |

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |   |
|---|---|
| <b>નાઈટ્રોફુરાન્ટોઇન.</b><br><b>(કુયરાન્ટીન- Furadantin)</b>            | <b>ચેતવણી</b><br>  |
| <b>મૂત્રપિંડ તેમજ મૂત્રાશયના ચેપોમાં વપરાતી આ એક જીવાળુનાશક દવા છે.</b> |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>                                      |  <b>દીકરીઓ 50 મિગ્રા અને 100 મિગ્રા</b>  |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>                            |  <b>મૂત્રાશયના ચેપ માટે :<br/>50 મિગ્રા દિવસમાં ચાર વખત - 7 દિવસ માટે</b><br><b>મૂત્રપિંડના ચેપ માટે :<br/>100 મિગ્રા, દિવસમાં ચાર વખત - 7 દિવસ માટે</b> |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>                                     |  <b>મૂત્રપિંડમાં ચેપ લાગ્યા પહેલા જે મૂત્રપિંડની કામ કરવાની ક્ષમતામાં<br/>કુંઈ ઉણાપ હોય તો<br/>સગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં</b>                        |
| <b>આડઅસરો :</b>   |  <b>ઉંફા, ઉલ્ટી, માથાનો દુ:ખાવા,<br/>“ગેસ” થવો</b>   |
| <b>દવા વધુ પડતી<br/>માત્રામાં લેવાઈ<br/>જથું તો :</b>                   |  <b>ઉલ્ટી, છાતીમાં દુ:ખાવો</b>   |
| <b>બીજુ ઉપયોગી<br/>દવાઓ :</b>   | <b>મૂત્રપિંડ કે મૂત્રાશયના ચેપ માટે :<br/>અમ્પીસિલીન, એમ્પોક્સીસિલીન, કો-ટ્રાયમોક્ઝોલ,</b><br><b>એરીથ્રોમાયસીન, નોર્ફલોકસાસીન</b>   |



## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |  |   |
|--|--|---|
| <b>નોરફ્લોક્સાસીન<br/>norfloxacin</b>  | (બાયોફ્લોક્ઝિન-Biofloxacin, નોર્ચુ-Nor-u, નોરફ્લોક્સ-Norflox,<br>નોરીલેટ-Norilet, ક્વીનોલોક્સ-Quinolox, ટેમ્પ્ફ્લોક્સ-Tampflox)  |     |
| <p>કવીનોલોન વિભાગની આ એક જીવાણુનાશક દવા છે, જેનો ઉપયોગ ગોનોરિયા, મૂત્રાશયના ચેપો, મૂત્રપિંડના ચેપો અને ગંભીર પ્રકારના જાડાની સારવારમાં થાય છે.</p> |  |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>   |   | <b>દીકરીઓ : 100, 200 અને 400 મિગ્રા</b>   |
| <b>કથારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>  |   | <b>મૂત્રાશયના ચેપ માટે : 400 મિગ્રાની દીકરી દિવસમાં બે વાર 3 દિવસ માટે લેવી.<br/>(જમવાના એક કલાક પહેલા કે બે કલાક પછી લેવી)</b><br><b>મૂત્રપિંડના ચેપ માટે : 400 મિગ્રાની દીકરી દિવસમાં બે વાર 10 દિવસ માટે લેવી.<br/>આધાના એક કલાક પહેલાં કે બે કલાક પછી લેવી)</b><br><b>પેઢુના સોજાની સારવારમાં અથવા તો યોનિમાર્ગમાંથી નીકળતા પ્રવાહીની સારવાર કે ગોનોરિયા માટે<br/>800 મિગ્રા એક જ વાર લેવી</b><br><b>એઈડસ વાળા વ્યક્તિને જાડા થાય તો તેની સારવારમાં<br/>400 મિગ્રા દિવસમાં બે વાર 5 દિવસ માટે</b> |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>  |   | <b>સગર્ભાલ્કીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, 16 વર્ષની ઉપરથી નીચે<br/>જેને કવીનોલોન વિભાગની કોઈપણ જીવાણુનાશક દવાની એલર્જી હોય.</b>   |
| <b>આડઅસરો :</b>  |   | <b>Light headedness</b><br><b>કેફીન નામના તત્વની અસરમાં વધારો, ઉફ્કા, ખાવાની દરદીન થવી-જાડા,<br/>પેટમાં ચૂંક આવવી, ચામડી પર ચાઠા ઉપસી આવવા.</b>   |
| <b>ચેતવણી :</b>  |   | <b>પુષ્ટળ પાણી સાથે દવા લેવી, લોહતત્વ કે જીન્ક વાળી દવાઓ કે એન્ટાર્સીડ ચાલુ<br/>હોય તો આ દવા ન લેવી.</b><br><b>જે નોરફ્લોક્સાસીનથી પ્રતિક્રિયા (એલર્જી) થાય તો દવા લેવી બંધ કરવી.</b>   |
| <b>બીજુ ઉપયોગી<br/>દવાઓ :</b>  | <b>મૂત્રપિંડ કે મૂત્રાશયના ચેપો માટે :</b><br><b>ઔર્મીસીલીન, એમોક્સીસિલીન, કોટ્રાયમોક્ઝેઝોલ, ઈરીથ્રોમાયસીન, નાઇટ્રોફ્યુરેન્ટોઇન<br/>ગોનોરિયા માટે : સીપ્રોફ્લોક્સાસીન, સેફ્ટ્રાયોક્ઝોન, સેફ્ટ્યુક્ઝાઇમ, કેનામાયસીન<br/>એઈડસના દર્દીમાં જાડા માટે : મેટ્રોનિડેઝોલ, કોટ્રાયમોક્ઝેઝોલ</b> |   |

## પુસ્તકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

### નીસ્ટેટીન nystatin

(માયકોસ્ટેટીન-Mycostatin, માયકોસ્ટેટીન વજાનલ-Mycostation Vag.)

આ એક ફૂગથી લાગતા ચેપની સારવારમાં અપાતી દવા છે. તેનો ઉપયોગ મુખ્યત્વે મોઢાના, ત્વચાનો કે ઘોનિમાર્ગના ફૂગથી થતા ચેપોની સારવારમાં થાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



દીકરીઓ : 5 લાખ યુનિટ  
ઘોનિમાર્ગમાં મૂકવાની દીકરી - 1 લાખ યુનિટ  
મલમ : 1%

કયારે અને કેટલી  
માત્રામાં લેવી :



મોઢાના કે ગળાના ચેપ માટે :  
દિવસમાં ત્રણ કે ચાર વાર મોઢામાં મમળાવવી.

ઘોનિના ચેપ માટે :  
રોજ રાતે સૂતી વખતે 1 દીકરી ઘોનિમાં 10 થી 14 દિવસ માટે મૂકવી.

ચામડીના ચેપ માટે :  
દિવસમાં ત્રણ વાર મલમ લગાવવો.

ચેતવણી :



જો નિસ્ટેટીનથી બળતરા કે ચચરાટ થાય તો વાપરવી નહીં.  
3 કે 4 દિવસ સુધી સમાગમ ટાળવો, નહીં તો જીતીય સાથીને ચેપ  
લાગી જવાની સંભાવના છે.

ઉપયોગી માહિતી :



નીસ્ટેટીન ફક્ત કેન્દ્રીયા નામની ફૂગથી થતા ચેપમાં જ વાપરવામાં આવે છે.  
માઈકોનેઝોલ બીજુ ફૂગથી થતા ચેપમાં પણ વાપરી શકાય.  
કલોટ્રાયમેઝોલ વાપરવામાં સરળ અને પ્રમાણમાં સસ્તી દવા છે.

બીજુ ઉપયોગી  
દવાઓ :

થીસ્ટ (એક જતની ફૂગ) થી થતા ચેપ માટે  
માઈકોનેઝોલ, કીટોકોનેઝોલ, કલોટ્રાયમેઝોલ, વિનેગર (સરકો),  
જેન્શન વાયોલેટ (જામલી દવા)



## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <b>ઓક્સીટોસીન<br/>oxytocin</b>              | (ગાયનોટોસીન-Gynotocin, મેરિટોનિન-Meritonin, પિટોસીન-Pitocin,<br>સીન્ટોસીનોન-Syntocinon)  |
|   | <p>ગર્ભાશયના સ્નાયુઓ અને રક્તવાહિનીઓનું સંકોચન કરીને સુવાવડ પછી થતા રક્તસ્વાવને કાબુમાં લાવવાનું કામ આ દવા કરે છે. જે ઓરને બહાર આવતા એક કલાક જેટલો સમય વીતી જય તો પણ આ દવા વાપરી શકાય.</p>   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>          |  <p>ઇન્જેક્શન : 1 મિલીમાં 5 યુનિટ</p>   |
| <b>કયારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b> | <p>બાળકના જરૂર પછી 10 યુનિટ્સનું ઇન્જેક્શન સ્નાયુમાં આપવામાં આવે છે.<br/>જે જરૂર જણાય તો દર દસ મિનીટના આંતરે આ દવા ફરી આપી શકાય.<br/> સુવાવડની શરૂઆત કરવા માટે (Induction of labour) આવા વખતે ગ્લુકોઝ - 5% નો 500 મિલીનો બાટલો નસમાંથી આપવામાં આવે છે, જેમાં 5 યુનિટ દવા નાખવામાં આવે છે.</p> |
| <b>આડઅસરો :</b>                             |  <p>આ દવાથી ગર્ભાશયના સ્નાયુઓનું સંકોચન થાય છે.<br/>કોઈ વાર આ સંકોચન એટલું જોરદાર હોય છે કે ગર્ભાશયના સ્નાયુઓને તેના પછી વિરામ નથી ભણતો અને ગર્ભાશય ફાટી જઈ શકે છે.</p>   |
| <b>ચેતવણી :</b>                             |  <p>લોહીનું ઉચ્ચું દ્વારાણ.<br/>આ દવાનો ઉપયોગ ગર્ભપાત કરવા ન કરવો જોઈએ નહીં તો ગર્ભપાત પહેલા જ સીનું મૃત્યુ થઈ શકે.<br/>આ દવાનો ઉપયોગ સુવાવડને ઝડપી બનાવવા ન કરવો નહીં તો તે માતા અને બાળક બન્ને માટે ખતરા રૂપ થઈ શકે. બાળક બહાર આવે તે પહેલા આ દવા ન આપવી.</p>                             |
| <b>બીજુ ઉપયોગી<br/>દવાઓ :</b>               | <p>સુવાવડ પછીના અતિશય રક્તસ્વાવ માટે :</p> <p>અર્ગોમેટ્રીન વાપરવી જોઈએ.</p>  |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <p><b>પેરાસીટેમોલ (એસીટામીનોફેન)</b><br/><b>paracetamol (acetaminophen)</b></p> <p>એક જ દવાના આ બે નામ છે અને આ દવા દર્દશામક અને તાવ ઓછો કરનારી છે. આ દર્દશામક દવા ઘણી સલામત છે. પેટમાં ચાંદુ હોય તેવી વ્યક્તિઓ પણ આ દવા એસ્પીરીન કે આયબુપ્રોફેનની જગ્યાએ લઈ શકે છે. આ દવાનો ઉપયોગ સગર્ભાસીઓ પણ કરી શકે છે અને જે ઓછી માત્રામાં લેવામાં આવે તો બાળકોને પણ આ દવા આપી શકાય.</p> | <p>(કાલપોલ-Calpol, કોસીન-Crocin, ફેબ્રેક્સ-Febrex, ફેબ્રિનિલ-Fibrinil,<br/>પેસીમોલ-Pacimol, મેટાસીન-Metacin, અલટ્રાજુન-Ultragin)</p>   |
| <p><b>દવાના ઉપલબ્ધ સ્વરૂપો :</b></p>   | <p>ટીકીઓ 300 મિગ્રા, 500 મિગ્રા, 650 મિગ્રા.<br/>નાના છોકરાઓ માટેની ટીકીઓ 125 અને 250 મિગ્રા.<br/>પ્રવાહી (60 મિલી) 125 મિગ્રા/5 મિલી.<br/>દીપાઓ (15 મિલી) 150 મિગ્રા/1 મિલી.<br/>ઇન્જેક્શન 150 મિગ્રા/મિલી, 1 મિલી.</p> |
| <p><b>કચારે અને કેટલી માત્રામાં લેવી :</b></p>   | <p>500–1000 મિગ્રા દિવસમાં 4 થી 6 વાર<br/>દિવસમાં 4 ગ્રામથી વધારે ન લેવી.<br/>બાળકોમાં માત્રા - 15 મિગ્રા દર કિલો વજન પ્રમાણે દિવસમાં 4 વખત.</p>   |
| <p><b>કોણે આ દવા ન લેવી જોઈએ :</b></p>   | <p>મૂત્રતંત્રના રોગો<br/>યકૃતના રોગો</p>   |
| <p><b>ચેતવણી :</b></p>   | <p>જે તાવ કે દુઃખાવો ત્રણ દિવસ કરતાં વધુ સમય રહે તો તબીબની સલાહ લેવી.<br/>યકૃતને નુકશાન પહોંચી શકે જે આ દવા વધુ માત્રામાં લેવાઈ ગઈ હોય<br/>અથવા તો આ દવા દારુના સેવન પછી લેવાઈ હોય</p>                                   |
| <p><b>ઉપયોગી માહિતી :</b></p>    | <p>આ દવાથી રોગ મટતો નથી - ફક્ત તાવ કે દુઃખાવો ઓછો થાય છે.<br/>આ તાવ કે દુઃખાવાનું કરણ શોધી તેની સારવાર કરવી ઘણું મહત્વનું છે.</p>  |
| <p><b>દવા વધુ પડતી માત્રામાં લેવાઈ જય તો :</b></p>   | <p>ઉંફા<br/>ઉલ્ટીઓ<br/>પેટમાં દુઃખાવો થવો</p>  |
| <p><b>બીજી ઉપયોગી દવાઓ :</b></p>  | <p>દુઃખાવા, તાવ કે સોજા માટે : એસ્પીરીન, આયબુપ્રોફેન (સગર્ભાવસ્થામાં ન લઈ શકાય)<br/>સખત દુઃખાવા માટે : કોડીન.</p>  |

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |  |
|---|--|
| <b>પેનીસીલીન</b><br><b>(કોયપેન-Kaypen)</b><br><b>penicillin</b>   |  |
| મોટું, દાંત, ગર્ભાશય, ત્વચા અને બીજા અનેક ચેપોમાં વપરાતી આ એક જીવાણુનાશક દવા છે.  |  |
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો :  | <br>દીકરીઓ : 125 મિગ્રા અને 250 મિગ્રા  |
| <br>કયારે અને કેટલી<br>માત્રામાં લેવી :<br><br>ન લેવી જોઈએ : | સુવાવડ પછી થતા ગર્ભાશયના ચેપમાં :<br>250 મિગ્રા દિવસમાં 4 વાર 7 દિવસ માટે<br>ત્વચાના ચેપો માટે : 250 મિગ્રા - દિવસમાં 4 વાર, 10 દિવસ માટે<br>ગંભીર પ્રકારના ચેપમાં : 500 થી 750 મિગ્રા, દર 6 કલાકે 7 થી 10 દિવસ માટે<br>આ ઉપરાંત આ દવાનો ઉપયોગ ક્ષસનતત્ત્વના કેટલાક ચેપોમાં થાય છે જેવા કે<br>ટોન્સીલનો ચેપ, સાયનસમાં થતો ચેપ, કાનની અંદરના ભાગમાં થતો ચેપ વગેરે |
| <br>કોણે આ દવા<br>ન લેવી જોઈએ :                             | પેનીસીલીન જૂથની કોઇપણ દવાથી જે એલર્જી (પ્રતિક્રિયા) થતી<br>હોય તો  |
| <br>આડઅસરો :   | ચામડી પર ચાઠાં પડવા  |
| <br>ચેતવણી :   | પ્રતિક્રિયાના ચિનહો,<br>એલર્જીથી થતો shock   |
| <b>બીજુ ઉપયોગી</b><br><b>દવાઓ :</b>   | ત્વચાના ચેપો માટે : એમ્પીસીલીન, એમોક્સીસીલીન, એરીથ્રોમાયસીન<br>સુવાવડ પછી થતા ચેપમાં : પ્રોકેન પેનીસીલીન, એમોક્સીસીલીન, મેટ્રાનીડિઝોલ  |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|   |   |   |
|---|---|---|
| <b>પોડોફિલાઇન<br/>podophyllin</b>   | (કોન્ડીલીન-Condyline, પોડોવાર્ટ પેઇન્-Podowart Paint)                               |    |
| જતીય અંગો પર થતા ભસાઓ પર આ દવાનું પ્રવાહી લગાડવાથી તે ભસાઓ સંકોચાઈ જય છે. |   |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>  |    | પ્રવાહી 3.5 મિલી (1 મિલીમાં 5 મિગ્રા દવા)<br>લગાડવા માટેનું પ્રવાહી - 20% - 10 મિલી   |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>                              |    | ઢાના પૂમડા કે સ્વરચ્છ અને મુલાયમ કાપડ વડે ભસા પર આ પ્રવાહી લાગાડવું.<br>4 કલાક પછી સાબુ અને પાણીથી એ જગ્યા ધોઈ લેવી. અઠવાડિયામાં<br>એકવાર અનો ઉપયોગ કરવો અને સારવાર 4 અઠવાડિયા સુધી ચાલુ રાખવી. |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>                                       |   | સગર્ભા સ્ત્રીઓ<br>સ્તનપાન કરાવતી ભાતાઓ  |
| <b>આડઅસરો :</b>   |  | ત્વચા પર બળતરા કે ચચરાટ   |
| <b>ચેતવણી :</b>   |  | જે ભસામાંથી લોહી નીકળતું હોય તો આ દવા ન વાપરવી.<br>જે irritation થાય તો ફરી આ દવાનો ઉપયોગ ન કરવો.   |
| <b>ઉપયોગી માહિતી :</b>  |  | પોડોફિલાઇનથી સ્વસ્થ ત્વચાને ધર્થું irritation થાય છે -<br>તેથી ભસાની આસપાસ પેટ્રોલીયમ જોતી (વેસેલીન)<br>લગાડવા પછી દવા લગાવવી.  |
| <b>દવા વધુ પડતી<br/>માત્રામાં લેવાઈ<br/>જય તો :</b>                       |  | ઉષ્ણ, ઉલ્ટી, પેટમાંનો દુઃખાવો, ઝાડા,<br>ચામડી પાતળી થઈ જય કે પછી એમાં ચીરા પડીને રક્તસ્વાબ<br>શરૂ થઈ શકે.   |
| <b>બીજુ ઉપયોગી<br/>દવાઓ :</b>   | <b>જતીય અંગો પર થતા ભસાઓ માટે :</b>   | <b>દ્રાયકલોરોએસીટિક એસીડ, બાય કલોરોએસેટીક એસીડ</b>  |

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

| પ્રોબેનેસીડ<br><b>probenecid</b>   | (બેન્સીડ-Bencid)   | ચેતવણી   |
|--|--|--|
| પેનીસીલીન જૂથની કેટલીક લ્વાણુનાશક દવાઓ સાથે આ દવા લેવાથી લોહીમાં પેનીસીલીનનું પ્રમાણ લાંબા સમય સુધી ઉંચું રહે છે અને એટલે સારવાર વધારે કાર્યક્ષમ બને છે. |  |  |
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો :   |   | દીકરીઓ : 500 મિગ્રા  |
| કયારે અને કેટલી<br>માત્રામાં લેવી :<br><br>                             | પેનીસીલીન જૂથની લ્વાણુનાશક દવાઓ સાથે જ્યારે જ્યારે પેનીસીલીન જૂથની દવા<br>લઈએ ત્યારે ત્યારે 500 મિગ્રાથી 1 ગ્રામ સુધી લેવી.<br>ગાઉટ માં : 500 મિગ્રા દિવસમાં બે વાર. |  |
| કોણે આ દવા<br>ન લેવી જોઈએ :  |   | નાના બાળકો (2 વર્ષથી નીચે)<br>જેને મૂત્રપિંડની બિમારી હોય. |
| આડઅસરો :<br><br>  | માથાનો દુઃખાવો, ચામડી પર ચાઢા ઉપસી આવવા, ઉફા-ઉલ્ટી,<br>વધારે માત્રામાં લેવામાં આવે તો ખેંચ આવે અને મૃત્યુ પણ થઈ શકે.   |  |
| ચેતવણી :<br><br>  | સગર્ભાવસ્થા દરમિયાન, સ્તનપાન કરાવતા હોય ત્યારે, પેટમાં ચાંદુ હોય ત્યારે<br>સાવધાની રાખવી.  |  |
| દવા વધુ પડતી<br>માત્રામાં લેવાઈ<br>જય તો :   |   | ઉલ્ટીઓ   |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### પ્રોકેઇન પેનીસીલીન procaine penicillin

(બિસ્ટ્રેપન-Bistrepan, ફોર્ટિફિઝેડ પ્રોકેઇન પેનીસીલીન-Fortified Procaine Penicillin)

નોંધ : ફક્ત પ્રોકેઇન પેનીસીલીન હોય તેવી કોઈપણ દવાની બનાવટ ભારતમાં ચાઢીપત્રકમાં નથી. બધી જ બનાવટોમાં પ્રોકેઇન પેનીસીલીન બેન્જાઈલ પેનીસીલીન જોડે જ સંચોળનમાં મળે છે. બન્ને ઘટકોની માત્રા જુદી જુદી હોઈ શકે) બીજી બધી માહિતી બેન્જાઈલ પેનીસીલીન જેવી જ છે.



### પ્રોજેસ્ટેરોન - પ્રોજેસ્ટીન progesterone, progestin

પ્રોજેસ્ટેરોન જેવું જ રસાયણિક માળખું ધરાવતું પ્રોજેસ્ટીન ગર્ભનિરોધક દવામાં (ટીકડી કે ઈન્જેક્શન) હોય છે. જ્યારે જ્યારે અંતઃસ્વાવનું પ્રમાણ વધ-ઘટ થાય ત્યારે ત્યારે થતા અનિયભિત રક્તસ્વાવની સારવારમાં પણ આ દવા વાપરી શકાય. (ગર્ભ નિરોધક તરીકેના ઉપયોગ માટે જુઓ પ્રકરણ નંબર ૧૨)



## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

| પ્રોમિથાઇન<br>promethazine   | (એવોમીન-Avomine, ફીનરગાન-Phenergan)  | ચેતવણી |
|--|--|--------|
| આ દવાથી શરીરમાં પેદા થતું ચીકણું પ્રવાહી સુકાઈ જય છે અને ઉંઘ આવવા લાગે છે. શરીરમાં થતા એક રસાયણ-હિસ્ટામીનથી એની બધી ડિયાઓ ઉંઘી હોય છે. એના ઉપયોગો આ પ્રમાણે છે. (૧) પ્રતિકિયામાં (૨) રાતે ઉંઘ લાવવામાં અને (૩) કાખું બહારની ઉલ્ટીને વશમાં લાવવા. |  |        |
| દવાનાં ઉપલબ્ધ<br>સ્વરૂપો :   | <br>ટીકીઓ : 10 મિગ્રા અને 25 મિગ્રા<br>પ્રવાહી : 5 મિલીમાં 5 મિગ્રા (60 મિલી)<br>ઇન્જેક્શન : 2 મિલી - 1 મિલીમાં 25 મિગ્રા   |        |
| કથારે અને કેટલી<br>માત્રામાં લેવી :<br><br>   | પ્રતિકિયામાં : 25 મિગ્રા - મોઢેથી અથવા ઇન્જેક્શન આઠ કલાક પછી ફરી આપી શકાય.<br>(જરૂર જરૂરાય તો વહેલા પણ આપી શકાય.)<br><b>allergic shock માં</b><br>50 મિગ્રાનું ઇન્જેક્શન (સ્નાયુમાં) - આઠ કલાક પછી ફરી આપી શકાય.<br>(જરૂર જરૂરાય તો વહેલા આપવું.)<br>ઉલ્ટી માટે 25 થી 50 મિગ્રા દર 6 કલાકે<br>ઉંઘ માટે 25 થી 50 મિગ્રા સૂતી વખતે |        |
| કોણે આ દવા<br>ન લેવી જોઈએ :<br><br>   | સગર્ભાંગીઓ/ધાર્ની માતાઓ - લાંબો સમય સુધી આ દવા વાપરવી નહીં<br>જે સંજગ રહેવાની જરૂર હોય તો આ દવા લેવી નહીં.   |        |
| આડઅસરો :<br><br>  | મોઢું સુકાઈ જવું,<br>દ્રષ્ટિ ધૂંધળી થઈ જવી. કોઈક જ વાર શરીર,<br>ચહેરા કે આંખના સ્નાયુઓ ફરકવા.  |        |
| ચેતવણી :<br><br>  | સગર્ભાંગીઓ/ધાર્ની માતાઓ - એ સાવધાની રાખવી<br>જે આ દવા લેતા હોય તો વાહન ન ચલાવવું.<br>જે આ દવા લેતા હોય તો ભારે ચંત્ર સામગ્રીનું કામ ન કરવું.   |        |
| દવા વધુ પડતી<br>માત્રામાં લેવાઈ<br>જય તો :<br><br>  | બેભાન થઈ જવું<br>તાણ આવવી  |        |
| બીજુ ઉપયોગી દવાઓ :<br>ડાયફીન હાયડ્રોમાઈન હાયડ્રોક્સીજીન  |  |        |

## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### પાયરાજિનેમાઇડ pyrazinamide

(આલજાઇડ-Alzide, કોપીરાજીન-Copyrazin, મેકોઝાઇડ-Macrozide,  
પીરાલ્ડિના-Piraldine, પાયજીના-Pyzina)



આ દવાનો ઉપયોગ ક્ષયરોગીની સારવારમાં થાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



દીકરીઓ : 250 મિગ્રા, 500 મિગ્રા, 750 મિગ્રા, 1000 મિગ્રા  
1500 મિગ્રા  
પ્રવાહી : 5 મિલીમાં 250 મિગ્રા (100 મિલીની શીશી)

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



દિવસમાં 20 થી 35 મિગ્રા, વજનના દર કિગ્રા માટે  
(લગભગ 25 મિગ્રા 1 કિગ્રા માટે)  
વધુમાં વધુ - 1500 મિગ્રા - દૈનિક

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



જે વ્યક્તિને યકૃતની કોઈ પણ તકલીફ હોય તેણે આ દવા ન લેવી.

આડઅસરો :




ચામડી પીળી પડી જવી, આંખો પીળી પડી જવી, યકૃતનો દુઃખાવો,  
તાવ, ભૂખ મરી જવી, ગાઉટ - વા

ચેતવણી :



સગર્ભા/ધાત્રી માતાઓ : આ દવાનો ઉપયોગ ટાળવો કારણકે આની  
અસર બાળક પર કેવી થાય તેની માહિતી નથી.  
આ દવાનો આખ્યો કોર્સ પૂરો કરવો જોઈએ.  
એમ ન કરવાથી બીજુ વ્યક્તિને ચેપ લાગી શકે છે.



## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

|   |   |  |
|---|---|--|
| <b>રીફામ્પિસીન<br/>rifampicin</b>   | (કોક્સિડ ૪૫૦-Coxid-450, ફામ્સીન-Famcin, મેકોક્સ-Macox,<br>આર-સીન-R-Cin, રીફસીલીન-Rifacillin, રીફામ્યેસીન-Rifamycin) |  |
| <p>આ એક જીવાણુનાશક દવા છે. જેનો ઉપયોગ ક્ષયરોગની સારવારમાં થાય છે, આ ઉપરાંત આ દવા લેપ્રસી અને બીજા ડેટલાક ચેપીરોગની સારવારમાં પણ વાપરી શકાય.</p> |   |  |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>  |   | <b>દીકરીઓ/કેપસ્યુલ :</b><br>150 મિટ્રા, 300 મિટ્રા, 450 મિટ્રા, 600 મિટ્રા.<br><b>પ્રવાહી :</b><br>5 મીલીમાં 100 મિટ્રા (શીરી 200 મિલીની આવે છે.)  |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>  |   | દૈનિક 8 થી 12 મિટ્રા, વજનના દર કિગ્રા પ્રમાણે (લગભગ 10 મિટ્રા વજનના દર કિગ્રા મુજબ) દિવસમાં વધુમાં વધુ 600 મિટ્રા દવા લેવી. આ દવાની માત્રા પણ અલગ અલગ ભૌગોલિક ક્ષેત્રોમાં અલગ અલગ હોઈ શકે.   |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>   |   | ઘૃતતની કોઈપણ જાતની તકલીફ હોય.  |
| <b>આડઅસરો :</b>   |   | ઉભા, ઉલ્ટી, ભૂખ ન લાગવી, ઝાડા, પેટમાં ચૂંક આવવી, ખંજવાળ, માથાનો દુઃખાવો, તાવ, ઢંડી વાવી, ચામડી પર ચાઠાં ઉપસી આવવા, હાડકાંઓમાં દર્દ થવું. ચામડી કે આંખો પીળી પડી જવી.   |
| <b>ઉપયોગી માહિતી :</b>  |   | <p>આ દવાનું સેવન કરનાર વ્યક્તિનો પેશાબ, ઝાડો, થૂંક, પરસેવો અને આંસુ - લાલથી કેસરી રંગનું થઈ જય.</p> <p>ક્ષયની સારવારમાં આ દવાનો સંપૂર્ણ કોર્સ કરવો - નહીં તો બીજી વ્યક્તિને ચેપ લાગી શકે છે.</p> <p>દવા ખાલી પેટે એટલે કે જમવાના ૧ કલાક પહેલાં કે ૨ કલાક પછી લેવી.</p> |



## પુસ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### સ્ટ્રેપ્ટોમાય્સીન streptomycin

(એમ્બિસ્ટ્રીન-એસ - Ambistryn-S)



અમાઈનોગ્લાકોસાઇડ જૂથની આ લુવાળુનાશક દવા ક્ષય રોગની સારવારમાં વપરાય છે. આ દવાને હંમેશા ઠંડેકશનથી સ્નાયુમાં આપવામાં આવે છે. ક્ષય રોગમાં આ દવા બીજી દવાઓની સાથે વપરાય છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઠંડેકશન :  
0.75 ગ્રામ અથવા તો 1.0 ગ્રામ

ક્ષયારે અને કેટલી  
માત્રામાં લેવી :



ક્ષયની સારવારમાં દવાની માત્રા નક્કી નથી. જુદી જુદી રીતે આપવામાં આવતી દવાઓમાં સ્ટ્રેપ્ટોમાય્સીનની માત્રા વધ-ઘટ થઈ શકે. પણ લગભગ 12 થી 18 મિગ્રા ફૈનિક (વજનના દર કિગ્રા માટે) આપવામાં આવે છે.

કોણે આ દવા  
ન લેવી જોઈએ :



સગર્ભા સ્ત્રીઓ - ગર્ભસ્થ બાળકમાં બહેરાશ આવી શકે.  
આ જૂથની બીજી દવાઓ પ્રત્યે પ્રતિક્રિયા હોય ત્યારે આ દવા ન વાપરવી.  
મૂત્રપિંડના રોગો/તકાતીક

આડઅસરો :



સંભળવા કે શરીરનું સમતોલન જળવવામાં મુશ્કેલી પડે.  
શરીર પર ચાઢાં આવી શકે.

ચેતવણી :



રબરના ગલવ્સ પહેરીને કામ કરવું. આ દવાના સીધા સંપર્કમાં આવવાથી ચામડી પર ચાઢાં ઉપસી આવે  
ક્ષયની સારવાર માટે જ્યારે આ દવાનો ઉપયોગ થતો હોય ત્યારે  
ક્ષયની બધી દવાઓ પૂરતા સમય સુધી લેવી જોઈએ. જે એમ ન કરવામાં  
આવે તો બીજી લોકોને ચેપ લાગવાની સંભાવના રહે છે.



## પુષ્તકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

### સલ્ફિસોક્સેઝોલ

(ગન્ટ્રિસિન-Gantrisin)

### sulfisoxazole

આ દવા ભારતમાં દવાઓની યાદીમાં નથી.

આ દવા આ દવાઓની યાદીમાં પણ ના હોય તો ચાલે આપે બદલે આના જેવી જ - વધુ સારી - દવાઓ જેવી કે કોટ્રાયમોક્ઝેઝોલ વાપરવી જોઈએ.

### ટિટેનસ ટોક્સોઇડ

tetanus toxoid

આ એક જલતની રસી છે કે જે ધનૂર થતું અટકાવવા આપવામાં આવે છે. આ રસી ગર્ભાવસ્થા દરમ્યાન કે એના પછી અને ગર્ભપાત પછી પણ આપી શકાય. જે સગર્ભા લીને સગર્ભાવસ્થા દરમ્યાન આ દવાના બે ઠંજેકશન (કે ત્રણ ઠંજેકશન) આપવામાં આવે તો નાના બાળકને પણ ધનૂર સામે રક્ષણ મળે છે.

દવાનાં ઉપલબ્ધ  
સ્વરૂપો :



ઠંજેકશન : 0.5 મિલીની એમ્પ્યુલ  
5 ml (10 ડોઝ)ની વાયત

ક્યારે અને કેટલી  
માત્રામાં લેવી :



0.5 મિલીનું ઠંજેકશન જ્ઞાયુમાં 4 થી 6 અઠવાડિયાના અંતરે આપવું  
ત્રીજું ઠંજેકશન 6 થી 8 માસ પછી આપવું.  
ત્યારબાદ દર 10 વર્ષે એક ઠંજેકશન (0.5 મિલી) લેવું.  
સગર્ભાવસ્થામાં : આ દવાના બે ઠંજેકશનો, 7 મા અને 8 મા  
મહીનામાં આપવા. જે પહેલાં આ ઠંજેકશન ન લીધાં હોય તો ત્રણ  
ઠંજેકશનો 6ટા, 7મા અને 8મા મહીનામાં આપવાં.

આડઅસરો :




દુઃખાવો, થોડો સોને, લાલાશ થઈ જવી.

ઉપયોગી માહિતી :



આ રસી બધાને આપવી જોઈએ અને આપવાની શરૂઆત બાળપણમાં  
થાયી જોઈએ.  
આ રસી મોટે ભાગે ત્રિગુણી રસીના એક ભાગઢાપે આપવામાં આવે છે.



## પુષ્ટકમાં ખૂચવેલી દવાઓ વિશે માહિતી

|  |   |   |
|--|---|---|
| <b>ટેટ્રાસાયક્લીન<br/>tetracycline</b>   | (એંક્રોમાયસીન-Achromycin, હોસ્ટાસાયક્લીન-Hostacycline,<br>સુબામાયસીન-Subamycin, થ્રીઓસાયક્લીન-Threocycline) |   |
| આ જીવાળાના શક્તિ દવા ટેટ્રાસાયક્લીન જૂથની છે. આ દવાનો ઉપયોગ ઘણા ચેપમાં કરાય છે. જેવા કે કલાઈમેડીઅથી થતી ચેપ, સિફીલિસ, પેટુમાં સોજે આવવાનો રોગ - ચેપ, મૂત્રપિંડના ચેપો, મૂત્રાશયના ચેપો, અસનતંત્રના ચેપો, ઝાડા વગેરે. બીજી આજ જૂથની દવા - ડોક્સીસાયક્લીન પણ આ બધા ચેપમાં વાપરી શકાય. એનો બીજો લાભ એ છે કે તેની કિંમત ઓછી છે અને લેવામાં સરળ છે. |   |   |
| <b>દવાનાં ઉપલબ્ધ<br/>સ્વરૂપો :</b>   |   | કેપસ્યુલ : 250 મિગ્રા, 333 મિગ્રા, 500 મિગ્રા   |
| <b>ક્યારે અને કેટલી<br/>માત્રામાં લેવી :</b>   |   | કલાઈમેડીયાના ચેપ : 500 મિગ્રા, દિવસમાં ચાર વાર 7 દિવસ માટે<br>સિફીલિસમાં : 500 મિગ્રા, દિવસમાં ચાર વાર 15 દિવસ માટે<br>પેટુમાં સોજે આવવાના રોગ - ચેપ :<br>500 મિગ્રા, દિવસમાં ચાર વાર 10 દિવસ માટે<br>(આ બધા ચેપમાં બીજી દવાઓ પણ સાથે લેવાની હોય છે.)<br>(માત્રા ગણવાની બીજી રીત - વજનના દર કિગ્રા દીઠ 30 થી 50 મિગ્રા ફૈનિક લેવી. આ કુલ માત્રાના ચાર સરખા ભાગ કરી દરેક ભાગ દર 6 કલાકે લેવો. આ રીતે સારવાર 7 થી 14 દિવસ માટે કરવી.) |
| <b>કોણે આ દવા<br/>ન લેવી જોઈએ :</b>  |   | સગર્ભા સ્ત્રી, ધાર્તી માતાઓ (સ્તનપાન કરાવતી માતાઓ)<br>9 વર્ષથી ઓછી ઉંમરના બાળકો<br>ટેટ્રાસાયક્લીન જૂથની કોઈ પણ દવાથી પ્રતિક્રિયા થતી હોય તો   |
| <b>ચેતવણી :</b>  |   | ચામડી પર ચાઢાં ઉપસી આવવા - જે લાંબો સમય સુધી સૂર્યપ્રકાશમાં રહેવાનું થાય.<br>ઝાડા<br>પેટમાં તકલીફ થવી   |
| <b>ઉપયોગી માહિતી :</b>   |   | દૂધમાંથી બનાવેલ કોઇપણ વસ્તુ દવાના એક કલાકની અંદર ન લેવી.<br>એન્ટાસીડ દવા અને આ દવા સાથે ન લેવી.<br>જે દવાની એક્સપાયરી ડે આવી ગઈ હોય તો તે દવા ન જ લેવી.   |
| <b>આડઅસરો :</b>  |   | <b>બીજી ઉપયોગી દવાઓ :</b><br>કલાઈમેડીયા ચેપ માટે :<br>એમ્ક્રોમાયસીન, એરીથ્રોમાયસીન<br>સિફીલિસ માટે : બેન્જાથીન પેનીસીલીન<br>નાના બાળકની ઓંખની સારવારમાં :<br>એરીથ્રોમાયસીનનો મલમ  |

## પુષ્ટકમાં ભૂયવેલી દવાઓ વિશે માહિતી

### થાયાસીટેઝોન thiacetazone

ક્ષયરોગની સારવારમાં આ દવા આઇસોનાયાજીડ સાથે વાપરવામાં આવે છે.

### ગર્ભનિરોધ માટે ગોળીઓ :

મોટાભાગે ગર્ભનિરોધ ગોળીમાં બે પ્રકારના હોર્મોન હોય છે. ક્રીના શરીરમાં માસિકખ્રાવની પ્રક્રિયાને નિયંત્રણમાં રાખવા માટેના જે અંતઃક્રાવો જરે છે તેવા જ રસાયણો આ ગોળીઓમાં હોય છે. ઘણા જુદાજુદા નામોથી વેચાતી આ ગોળીઓમાં હોર્મોન્સની માત્રા વધતી ઓછી હોય છે. જે ગોળીમાં હોર્મોન ઓછા પ્રમાણમાં હોય તે વધુ સાલમત હોય છે. કેટલીક ગોળીઓ જે બજરમાં મળે છે તે અહીં આપેલ છે.

માલ-એન રાષ્ટ્રીય કુંભ-નિયોજન કાર્યક્રમમાં તદ્દન મફત મળે છે. માલા-ડી પણ બજરમાં વિવિધ નામે મળે જ છે. જેમ કે, એક્રોઝ (Ecroz), પર્લ (Peral), મોતી (Moti), ચોઈસ (Choice), વગેરે. દરેક પેકેટમાં ૨૮ ગોળી હોય છે. ૨૧ સફેદ ગોળીઓ ગર્ભનિરોધક છે અને ૭ કેસરી કે કાળી ગોળીઓ લોહિતત્ત્વની છે.

ગોળીની માત્રા : ૧ ગોળી (સફેદ) દરરોજ લેવી-માસિકના પાંચમા દિવસે શક્ક કરવાની છે. ૨૧ સફેદ ગોળી પૂરી થાય એટલે તરત જ કાળી કે કેસરી રંગની એક એક ગોળી દરરોજ લેવાની છે. ૨૮ ગોળીઓ પૂરી થયા પછી તરત નવુ પેકેટ ચાલુ કરી દેવું. માસિક ચાલુ હોય તો પણ ગોળીઓ ચાલુ રાખવી.

બજરમાં મળતી બીજી ગોળીઓ, જેમ કે ટ્રાઇકવીલાર (Triquilar), ઓવરાલ-એલ (Ovral-L), ઓર્થો-નોવમ (Ortho-Novum), વગેરેમાં ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન ઓછી માત્રામાં હોય છે.

જે બેનોને માસિક વખતે ઘણું વધારે લોહી પડતું હોય, અથવા માસિક પહેલાં સ્તનનો દુઃખાવો વધુ પ્રમાણમાં થતો હોય, તેમણે ગર્ભનિરોધની ગોળીમાં ઓછું ઇસ્ટ્રોજન અને વધુ પ્રોજેસ્ટીન હોય તે પ્રકારની ગોળી પસંદ કરવી. દા.ત. ઓવરાલ-એલ. આવી વધુ પ્રોજેસ્ટીન વાળી ગોળીઓથી કેટલીક વાર ચહેરા ઉપર ખીલ વધુ થાય છે કે હાથ ઉપર, હોઠની ઉપરના ભાગે વાળ વધુ ઉગવા લાગે એવું બને છે. તેથી જે તમને આ ના ફાવે તો પછી ઓછા પ્રોજેસ્ટીનવાળી ગોળીઓ લેવી જોઈએ.

કેટલીક બેનોને ઓવરાલ-એલ જેવી ઓછા ઈસ્ટ્રોજન વાળી ગોળી લેવાથી માસ દરમ્યાન દરરોજ જરા-જરા લોહીના ટીપા પડયા કરે કે કોઈ વાર માસિક બંધ થઈ જય એવું થાય તો વધુ ઈસ્ટ્રોજનવાળી ગોળીઓ લેવી જેઠાંએ. દા.ત. ઓવરાલ-જી (Ovral-G), ડ્યુઓલુટોન-એન (Duoluton-N), ઓરગોલુટિન (Orgalutin), ઓવ્યુલેન (Ovulen), માલા-ડી (Mala-D), માલા-એન (Mala-N), જે બેનો સગર્ભા હોય તેમણે ગર્ભનિરોધક ગોળી લેવી નહિ. છેલ્લા દિવસમાં જેને ડાયાબીટીસ, ઉંચું બ્લડપ્રેશર, કમળો કે કલેજન-ગોલ બ્લેડરનો અન્ય કોઈ રોગ થયો હોય તેમણે પણ ગર્ભનિરોધક ગોળી લેવી ના જેઠાંએ. તેવી જ રીતે જે બેનોને કેન્સર થયું છે તેવી આશંકા હોય, યોનિમાર્ગે અસામાન્ય લોહી પડતું હોય, તેમણે પણ આ ગોળીઓ લેવી નહીં. જે બેનો ૪૦ વર્ષથી મોટી છે, અથવા જેમને દમ, એલર્જી, આધારશિરી કે વાઇની બિમારી છે તેમણે પણ આ ગોળીઓ ડૉક્ટરની સલાહ વગર લેવી નહિ.

જ્યારે તમે ગર્ભનિરોધક ગોળી લેતા હોય ત્યારે જે બે માસ સુધી માસિક ના આવે, કે સ્તન કઠણ થઈ ગયા છે એમ લાગે કે જેવામાં (દિશિમાં) તકલીફ થઈ છે એમ લાગે તો તરત જ ડૉક્ટરને મળવા જવાની જરૂર છે.

સેન્ટ્કોમાન હોમ્મોન વગરનું ગર્ભનિરોધક રસાયણ છે જે ભારતમાં જ શોધવામાં આવ્યું છે. તે અલગ અલગ નામથી બજારમાં મળે છે. દા.ત. સહેલી અને નોવેક્સ નામથી રાષ્ટ્રીય કુટુંબ નિયોજન કાર્યક્રમ હેઠળ તે મળે છે અને સેન્ટ્રોન નામથી બજારમાં તે મળે છે. તેની એક ગોળીમાં સેન્ટ્કોમાન ૩૦ મિ.ગ્રામ હોય છે.

**ગોળીની માત્રા :** માસીકના પ્રથમ દિવસથી અઠવાડિયામાં બે વાર એક એક ગોળી પ્રથમ ત્રણ માસ સુધી લેવાની હોય છે. તેના પછી દર અઠવાડિયે એકગોળી દરરોજ લેવાની છે.

જે બેનોને કમળો કે લીવર (કલેજ) નો અન્ય રોગ હોય તેમણે આ ગોળી ના લેવી.

**તાત્કાલિક ગર્ભનિરોધની ગોળીઓ :**

જ્યારે સ્ત્રી પર બળાત્કાર થયો હોય, સંબંધ વખતે નિરોધ ફાટી જય કે નિયમિત વાપરવાના ગર્ભનિરોધક વાપર્યા વગર સંભોગ થયો હોય ત્યારે મહિના ન રહી જય તે માટે તાત્કાલિક ગર્ભનિરોધની જરૂર પડે છે. આ ગોળીઓ સંભોગ બાદ ૭૨ કલાક પહેલાં લેવાય તો જ અસરકારક બને છે. જે તમે ઓછા હોમ્મોનવાળી ગર્ભ નિરોધક લેતા હો તો તમારે એક સાથે ૪ ગોળી લેવી પડે. ત્યારબાદ બીજી ૧૨ કલાકમાં બીજી ૪ ગોળી લેવાથી મહિના રહેતા નથી. આવી રીતે ગોળી લેશો તો ઉલ્ટી-ઉબકા જેવી આડ-અસર થશે પરંતુ તે મટાડવા માટે પ્રોમીથાજીનની ગોળી પણ તેની સાથે લેવી જેઠાંએ. તેનાથી ઉલ્ટી-ઉબકા થશે નહિ.

## પુસ્તકમાં સ્થૂયવેલી દવાઓ વિશે માહિતી

### ઇંજેક્શનથી લેવાના ગર્ભનિરોધક :

ઉપો-પ્રોવેરા નામથી ગર્ભનિરોધક ઇંજેક્શન બજલરમાં મળે છે. આ ઇંજેક્શન હજુ સુધી રાષ્ટ્રીય કુટુંબનિયોજન કાર્યક્રમમાં મળતા નથી. જે બેનોને મહિના રહ્યા હોય, ડાયાબીટીસ, ઉંચુ બ્લડપ્રેશાર, લોહીની નળીઓમાં લોહી જન્મી જવાનો રોગ (thromboembolic ફીનોમીના), લીવર (કલેન્ઝ) ની તકલીફ, કેન્સર, જેવા રોગ હોય તેમણે આ ઇંજેક્શન લેવું ના જેઠાંએ. આ ઇંજેક્શનની અસર ગોળીઓ જેવી જ હોય છે પરંતુ ઇંજેક્શન લીધા બાદ ત્રણ માસ સુધી તેની ગર્ભનિરોધક અસર રહેતી હોય છે. આમ લાંબા સમય સુધી લોહીમાં ફરતા રહેવાને કારણે તેની આડઅસર વગેરેનું બરાબર નિયમન કરવું જરૂરી બને છે. તબીબી ચેકઅપ અને સલાહ-સ્થૂયન વગર આ ઇંજેક્શન લેવા ના જેઠાંએ.

### શુક્કાણુનાશક રસાયણો :

ફોમ (ફીણા), જેલી, કીમ અને ગોળી સ્વરૂપે મળતા આ રસાયણો સંભોગ પહેલાં યોનિમાં મૂકવાથી શુક્કાણુનો નાશ કરે છે અને મહિના રહેતા નથી. નોનોક્સીનોલ-૧ (Nonoxynol-1) વાળા શુક્કાણુનાશકો કેટલાક જતીયરોગ કરનારા રોગાણુનો પણ નાશ કરે છે. જેકે કોઈપણ શુક્કાણુનાશકથી એચઆઈવી મરતા નથી, તેથી નિરોધ વાપરવાનો આગ્રહ રાખવો જેઠાંએ.

ભારતમાં આવા ગર્ભનિરોધક ફોમ, જેલી, વગેરે બહુ સહેતાઈથી મળતા નથી. સ્વીઓ વાપરી શકે તેવા ડાયાફામ (આડશા પદ્ધતિ) કે ગર્ભગ્રીવા ટોપી (સર્વાઈકલ કેપ) પણ સહેતાઈથી મળતા નથી. કીમ અને પેસરી (યોનિમાં મૂકવાની ગોળીઓ) મળે છે. તેને સંભોગની ૧૫ મિનિટ પહેલાં યોનિમાં મૂકવાના હોય છે. તેનાથી શુક્કાણુનો નાશ થાય છે. તે લગભગ ૧ કલાક સુધી અસરકારક રહે છે. જે તેને આડશાપદ્ધતિ સાથે વાપરવામાં આવે તો લગભગ ૬-૮ કલાક સુધી રક્ષણ આપે છે. જે કે પુરુષના કે સ્વીઓના નિરોધ વાપરવાથી એચઆઈવી અને બીજ જતીય રોગો સામે પણ રક્ષણ મળે છે.

(આ વિભાગ વોલન્ટરી હેલ્થ એસ્ઓ. ના પુસ્તકના આધારે બનાવવામાં આવ્યો છે.)

